

૧	સંસ્થાની વિગતો, કાર્યો અને રજો	<p>સંસ્થાના કાર્યો બી.પી.એમ.સી.એક્ટ ૧૯૪૮ સેક્સન ૬૬(૨૨)" લાઈબ્રેરીઓ, સંગ્રહાલય અને આર્ટ ગેલેરીઓની સ્થાપના અને જાળવણી તેમજ બોટનીકલ અથવા ઝૂંઓલોજી વિગેરેનાં સંગ્રહાલયોમાં વસ્તુઓની ખરીદી અને ત્યાં મકાનનું બાંધકામ"</p> <p>સુરત મહાનગરપાલિકા સંચાલિત કિલ્લામાં વિવિધ ગેલેરી આવેલી છે, જેમાં સરદાર વલ્લભભાઈ પટેલ ભૂલિયમની કલાકૃતિઓ વિવિધ ગેલેરીઓમાં પ્રદર્શિત કરવામાં આવેલ છે તથા આર્ટ ગેલેરી કમ એક્ઝિબિશન હોલ, કોન્ફરન્સ રૂમ, રેફરન્સ લાઈબ્રેરી, સોનીયર શોપ વિગેરેનો સમાવેશ થાય છે.</p>
૨	અધિકારીઓ અને કર્મચારીઓની સત્તા અને ફરજો	<p><u>અધિકારીઓ અને કર્મચારીઓની ફરજ નીચે મજબ છે:</u></p> <p>ક્યુરેટર (કિલ્લો)</p> <ul style="list-style-type: none"> કિલ્લા ખાતે મુલાકાતીઓને સાંભળવા તેમજ સમજ આપવી. કિલ્લામાં આવેલ આર્ટ ગેલેરી, કોન્ફરન્સ રૂમને જે તે સમયે ભાડે આપવામાં આવે ત્યારે તેની નોંધ રાખવી. ઉપરી અધિકારીઓ તરફથી મળતી લેખિત/મૌખિક સુચનાનું પાલન કરવું. કિલ્લા ખાતે ઈન્સ્પોરન્સ અને હાઉસકીપિંગની કામગીરી અને તેને લગતા રીપોર્ટ. વહીવટી કામગીરી જેવી કે મહેકમ, વેબસાઇટ, ડેડ સ્ટોક, સ્ટોર્સ વિગેરેનાં રિપોર્ટ. તાખા હેથળના કર્મચારીની રજા મંજૂર કરવી. કિલ્લાના ટેન્ડર અને કવોટેશનની કામગીરી કરવી. વખતો વખત ટેમ્પરરી એક્ઝિબિશનનું આયોજન, સ્કુલના બાળકોને પ્રોત્સાહિત કરવા સ્કુલ સાથે સંકલન કરી કાર્યક્રમનું આયોજન. આર્ટ ગેલેરી, કોન્ફરન્સ રૂમમાં કોઈ કાર્યક્રમ હોય ત્યારે જરૂર જાણાયે હાજર રહેવું અને રીપોર્ટ રજૂ કરવા. કિલ્લાના ઈન્સ્પોરન્સની કામગીરી રાઈટ ટુ ઈન્સ્પોર્મેશનને લગતી કામગીરી કરવી. વખતો વખત ખાતાના વડાશ્રી દ્વારા જે કોઈ કામગીરી લેખિત/ મૌખિક સુચના આપી સોંપવામાં આવે તે તમામ કામગીરીઓ કરવાની રહેશે. <p>આસી. ઈજનેર (ઇલેક્ટ્રોકલ) (ઓન લોન)</p> <ul style="list-style-type: none"> કિલ્લા ખાતે વિવિધ ઇલેક્ટ્રોકલ સાધનોની જાળવણી કરાવવી. ટોરેન્ટ પાવર લિ. સાથે પત્રવ્યવહાર કરવો. કિલ્લા ખાતને લગતી ઇલેક્ટ્રોકલ અને CCTV, HVAC, ડ્રો-બ્રિજ વિગેરે સાધન-સામગ્રીની જાળવણી અને એન્યુઅલ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ (AMC) અંગેની કામગીરી કરવી. કિલ્લા સિથિત આર્ટ ગેલેરી, કોન્ફરન્સ રૂમમાં જાહેર મુખ્ય કાર્યક્રમો દરમયાન હાજર રહેવું અને ઇલેક્ટ્રોકલ અને એરકુંડીશનીગની દેખરેખ કરાવવી. વખતો વખત ખાતાના વડાશ્રી દ્વારા જે કોઈ કામગીરી લેખિત/ મૌખિક સુચના આપી સોંપવામાં આવે તે તમામ કામગીરીઓ કરવાની રહેશે. <p>ગેલેરી આસીસ્ટન્ટ (ઓન લોન)</p> <ul style="list-style-type: none"> કિલ્લા ખાતે આવેલ ગેલેરીઓનાં શોકેસની જાળવણી, ડિસ્પ્લેની કામગીરી, મુલાકાતીઓને માર્ગદર્શન આપવું. કિલ્લાના ડોક્યુમેન્ટેશનને લગતી દરેક પ્રકારની કામગીરી કરવી. કિલ્લાની મુલાકાતે આવતા ડેલીગેશન તથા વિશેષ અતિથીઓની સાથે રહી સમજ આપવી. વખતોવખત સુરત મહાનગરપાલિકાના ઉપરી અધિકારીશ્રી, ખાતાના વડાશ્રી / ચીફ ક્યુરેટરશ્રી / ક્યુરેટર (ભૂલિયમ) /ક્યુરેટર (કિલ્લો) દ્વારા જે કોઈ કામગીરી લેખિત / મૌખિક સુચના આપી સોંપવામાં આવે તે તમામ કામગીરીઓ કરવાની રહેશે.

	<p>મેઈન્ટેનન્સ આસી. (ઇલેક્ટ્રોિકલ) (ઓન લોન)</p> <ul style="list-style-type: none"> કિલ્વા ખાતેના વિવિધ ઇલેક્ટ્રોિકલ CCTV, HVAC, ડ્રો-બિજ વિગેરે સાધન-સામગ્રીનું મેઈન્ટેનન્સ કરવું તથા દેખરેખ રાખવી. કિલ્વા ખાતેના ઇલેક્ટ્રોિકલ / એરકન્ડીશનીંગ બાબતના વિવિધ કામો બાબતે ઉપરી અધિકારી / આસી.ઇજનેર(ઇલે.)ની કામગીરીમાં મદદરૂપ થવું અને ઇલેક્ટ્રોિકલ સ્ટાફની કામગીરી ઉપર દેખરેખ રાખવી અને જરૂરી સૂચના આપવી. કિલ્વા સિથિત આર્ટ ગેલેરી, કોન્ફરન્સ રૂમ તથા જાહેર કાર્યક્રમોમાં ઉપસ્થિત રહીને ઇલેક્ટ્રોિકલ અને એરકન્ડીશનીંગની કામગીરીની દેખરેખ રાખવી. <p>ડેડ કલાર્ક (ખાલી)</p> <ul style="list-style-type: none"> સોવી-નીયર શોપને લગતી તમામ પ્રકારની કામગીરી કરવી અને કરાવવી, દરેક પ્રકારનાં શોપનાં રજીસ્ટરો તૈયાર કરવા, ડેડ સ્ટોક રજીસ્ટરની કામગીરી. શિષ્ટતાનું પાલન કરાવવું તથા વખતો વખત ખાતાના વડાશ્રી/ અધિકારીશ્રી દારા જે કોઈ કામગીરી લેખિત/ મૌખિક સૂચના આપી સૌંપવામાં આવે તે તમામ કામગીરીઓ કરવાની રહેશે. કિલ્વા ખાતે સિથિત આર્ટ ગેલેરી કમ એકઝીબીશન હોલ અને કોન્ફરન્સ રૂમમાં તેમજ કિલ્વાના પરિસરમાં કાર્યક્રમ હોય તે દરમિયાન હાજર રહેવું. <p>સીનીયર કલાર્ક (ખાલી)</p> <ul style="list-style-type: none"> કિલ્વાના ઇન્સ્યોરન્સનાની કામગીરી તેમજ ઇન્સ્યોરન્સની પોલીસી રીન્યુ કરાવવી તથા તેને લગતી કામગીરી કરવી. દરખાસ્ત તૈયાર કરવી, બજેટને લગતી કામગીરી, પ્રિમાયસીસ લાઈસન્સ અંગેની કામગીરી કરવી, ખર્ચ પત્રકની કામગીરી કરવી, ડેડ સ્ટોક રજીસ્ટર, સેન્ટ્રલ સ્ટોરને લગતી કામગીરી કરવી. આર્ટ ગેલેરી / કોન્ફરન્સ રૂમની માહિતી આપવી, E.C ની કામગીરી કરવી. <p>ત્રીજી શ્રેષ્ઠી કલાર્ક (૨)</p> <ul style="list-style-type: none"> હાઉસ કિપીંગના બીલ બનાવવાની કામગીરી, કોમ્પ્યુટર ઓપરેટરની હાજરી, તથા ઇન્સ્યોરન્સનાની કામગીરી કરવી. તમામ ટેન્ડરોની ફાઈલ ચલાવવી તેની EMD, સીક્યુરિટી રીપોર્ટ જમા કરાવવી. કિલ્વાના ટિકિટ વિન્ડો ઉપર કિલ્વો જોવા આવતા મુલાકાતીઓને ટિકિટ ઇસ્યુ કરવી, ટિકિટો અંગેનું સ્ટોક રજીસ્ટર તૈયાર કરવાની કામગીરી, ભરણા અંગેની કામગીરી, આવક અંગેના રજીસ્ટરો બનાવવા, નિભાવવા તથા આવેલ રકમનું ભરણું કરવું કિલ્વામાં આવેલ આર્ટ ગેલેરી, કોન્ફરન્સ રૂમના બુકીંગની, ફોટોગ્રાફી, વિડિયોગ્રાફી વિગેરેના બીલ બનાવવાની કામગીરી કરવી. કિલ્વાની મુલાકાતે આવનાર બાળકો તથા શિક્ષકોના બુકીંગ તેમજ અન્ય ગ્રુપ બુકિંગ અંગેની કામગીરી કરવી તથા ભરણાની કામગીરી કરવી. આઉટવર્ડ-ઇનવર્ડની કામગીરી કરવી. બહારથી આવતી ટપાલોના વિતરણની કામગીરી બાઈન્ડરો, ફાઈલો નોંધી ખાતાના વડાશ્રી/અધિકારીશ્રીની સહીમાં મુકવા. વખતોવખત ખાતાના વડાશ્રી/અધિકારીશ્રી દારા જે કોઈ કામગીરી લેખિત/મૌખિક સૂચના આપી સૌંપવામાં આવે તે તમામ કામગીરીઓ કરવાની રહેશે. <p>વાયરમેન (૩)</p> <ul style="list-style-type: none"> કિલ્વા ખાતેના વિવિધ ઇલેક્ટ્રોિકલ અને એરકન્ડીશનીંગ ઇક્વીપમેન્ટનું ઓપરેટીંગ અને મેઈન્ટેનન્સની કામગીરી આર્ટ ગેલેરી, કોન્ફરન્સ રૂમમાં પ્રોગ્રામ સમયે હાજર રહી ઇલેક્ટ્રોિકલ / એરકન્ડીશનીંગ, સાઉન્ડ સીસ્ટમ અંગેની કામગીરી કરવી.
--	---

		પટાવાળા (૧૧) <ul style="list-style-type: none"> કિલ્લા ખાતેની વહીવટી ઓફિસમાં ફાઈલો ગોઠવવી, રીપોર્ટ ફાઈલમાં ફાઈલ કરવા, કિલ્લાના વિવિધ ભાગોની ચાવી લાવી ગેલેરીઓ ખોલવી. ટપાલની કામગીરી, મુલાકાતીઓને લાઈનમાં ઉભા રાખવા તેમજ ગેલેરીઓ, આર્ટ ગેલેરી, કોન્ફરન્સ રૂમ, વોલ્ટ રૂમમાં મુલાકાતીઓની તકેદારી રાખવી. એકઝીબીટસના પ્રદર્શનમાં મદદ કરવી અને ઉપરી અધિકારીઓની સુચના મુજબ કામગીરી કરવી.
૪	કર્મચારીઓની કામગીરી અને ફરજો અંગોની કાર્યપ્રણાલી	<p>સોવેનીયર શોપ</p> <ul style="list-style-type: none"> કિલ્લા ખાતે સ્ટોલ એરીયામાં સોવેનીયર શોપ આવેલ છે. આ સોવેનીયર શોપમાં શહેરીજનોને ગ્રામ્ય હેન્ડી કાફિટ તથા સુરત મહાનગરપાલિકાના પદ્ધતીકેશન જેમ કે 'At The Core' અને 'A Tale Of Surat's Heritage', પોસ્ટકાર્ડ, ફોટોક્રેમ અને કોફી-મગ વિગેરે પણ વેચાણ અર્થે મૂકવામાં આવેલ છે. <p>આર્ટ ગેલેરી કમ એક્ઝીબીશન હોલ</p> <ul style="list-style-type: none"> આર્ટ ગેલેરી કમ એક્ઝીબીશન હોલ એ-૪ બિલ્ડીગના ભૌંયતણીયામાં આવેલ છે. તેનો અંદાજીત વિસ્તાર ૨૬૫ ચો.મીટર ઘરાવે છે તથા સંપૂર્ણપણે વાતાનીકુલીત છે. આર્ટ ગેલેરી કમ એક્ઝીબીશન હોલમાં સ્થાનિક કલાકારો પોતાની કલા પ્રદર્શિત કરી શકશે તેમજ વિવિધ પ્રકારના પ્રદર્શન સહ વેચાણ જેવા કાર્યક્રમના આયોજન માટે આદર્શ વ્યવસ્થા ઘરાવે છે. <p>કોન્ફરન્સ રૂમ</p> <ul style="list-style-type: none"> કોન્ફરન્સ રૂમ એ-૪ બિલ્ડીગના પ્રથમ માળ પર આવેલ છે, તથા ૪૦-૫૦ વ્યક્તિની બેઠક વ્યવસ્થા ઘરાવે છે. આ વ્યવસ્થા શૈક્ષણિક કાર્યક્રમ / સાહિત્યિક / સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ જેવી કે સંવાદ, વર્કશોપ, મીટિંગ, જુથ ચર્ચા, પ્રોજેટેશન, સાહિત્ય ગોષ્ઠી, પુસ્તક વિમોચન વિગેરે કાર્યક્રમ માટે આદર્શ વ્યવસ્થા છે.
૫	જાહેર તંત્ર અને કર્મચારીઓએ નિયંત્રણ હેઠળના અનુસરવાના નિતી નિયમો, સુચનો, મેન્યુઅલ્સ અને રેકડો.	<ol style="list-style-type: none"> બી.પી.એમ.સી.એક્ટ, ૧૯૪૮ સામાન્ય સભાનાં દરાવ સ્થાયી સમિતિનાં દરાવ સાંસ્કૃતિક સમિતિનાં દરાવ તથા જાહેર બાંધકામ સમિતિના દરાવ કિલ્લાના નિતી – નિયમો <ul style="list-style-type: none"> કિલ્લાની અંદર સ્વચ્છતા જળવાઈ રહે તે હેતુથી કિલ્લા પ્રિમાઈસીસમાં કોઈપણ પ્રકારના ખાદ્ય પ્રદાનો, ડાયપીણા, પાન મસાલા, ગુટખા, પ્લાસ્ટીક પાઉચ, કેરી બેગ્સ તથા અન્ય પ્રદૂષિત વસ્તુ લઈ જવા દેવામાં આવશે નહીં. બહારના ફેરીયાઓને કે સ્વયં સેવકોને કોઈપણ ખાવાપીવાની વસ્તુઓ વેચવા / વિતરણ કરવા દેવામાં આવશે નહીં. થેલીઓ, પાણીની થેલીઓ પાણીની બોટલો, વિગેરે કિલ્લાની મુલાકાત દરમ્યાન સાથે લઈ જવા દેવામાં આવશે નહીં. કિલ્લાની વિઝીટ દરમ્યાન શાંતિ રાખવી, મોબાઈલ ઉપર વાતો કરવાની મનાઈ, તેમજ મોબાઈલ સાયલન્ટ મોડ ઉપર રાખવો, થુંકવાની તથા ધૂમપ્રાપ્ત કરવાની સખ્ત મનાઈ છે. મુલાકાતીઓ જો કિલ્લામાં પાન મસાલા ખાતા પકડાશે કે પિચકારી મારતા પકડાશે તો નીતી નિયમો અનુસાર દંડને પાત્ર રહેશે. સક્ષમ અધિકારીની પરવાનગી વગર ફોટો / વીડીયો શુટીંગ કરવા દેવામાં આવશે નહીં. કોઈપણ પ્રકારની ફરિયાદ / સુચનો લેખિતમાં જણાવવી. મુલાકાતીઓએ તમામ સ્ટાફ જોડે વિવેકપૂર્ણ રીતે વરતું, ફરિયાદ અથવા સુચન ફરિયાદ બુકમાં લખવા. સીક્યુરિટી સ્ટાફ કે ફરજ પરનાં સ્ટાફ સાથે ગેરવર્તણુક કે ઝડપો કરવો નહીં. પાણેલા પ્રાણીઓ સાથે પ્રવેશ આપવામાં આવશે નહીં. ટીક્રીટ લીધા પછી પ્રવેશ મેળવ્યા બાદ દરેક મુલાકાતીએ ટીક્રીટ કિલ્લો છોડતા સુધી પોતાની પાસે રાખવાની રહેશે. કિલ્લાનો સમય મા.કમિશનરશ્રી વખતો વખત નક્કી કરે, એ મુજબનો

		<p>રાખવામાં આવશે.</p> <ul style="list-style-type: none"> એક વખત ટીક્રીટ લીધા બાદ ટીક્રીટ પરત લેવામાં આવશે નહીં કે નાણાં પરત આપવામાં આવશે નહીં. પ્રવેશ મેળવ્યા બાદ આકસ્મિક સંજોગોમાં કિલ્લો બંધ કરવામાં આવે તો રીફ્ડ ન આપતા ફરી કાર્યરત થતા એ જ ટીક્રીટ પર પ્રવેશ મેળવવાનો રહેશે. કુદરતી આફંતોના કારણે અગર જાહેર સુલેહ શાંતિ જોખમાય તેવા અસામાન્ય સંજોગોમાં કિલ્લો બંધ કરવાની પરિસ્થિતિ ઊભી થાય તો તેવા સંજોગોમાં પ્રવેશ ટીક્રીટની પુરેપુરી રકમનું રીફ્ડ આપવાની અથવા તારીખની ફેરબદલી કરી આપવાની સત્તા મ્યુ.કમિશનરશ્રી કે તેઓના અધિકૃત અધિકારીશ્રીનો નિર્ણય આખરી બંધનકર્તા ગણાશે. કિલ્લાની મિલકતને કે સાધનોને કોઈપણ પ્રકારનું નુકશાન થાય તો મ્યુ.કમિશનરશ્રી અથવા અધિકૃત અધિકારીશ્રી તેની કરેલ આકારણીની રકમ એટલે થયેલ નુકશાનની રકમ મુલાકાતી પાસેથી વસુલ કરી શકશે. અન્યથા જરૂર જણાય તો પોલીસ કાર્યવાહી કરવાને પાત્ર રહેશે. કિલ્લાની મુલાકાત દરમ્યાન આકસ્મિક સંજોગોમાં કોઈ દુંઘટના સર્જાંયને તેના થકી કોઈપણ મુલાકાતીને નુકશાન થાય તો તેની જવાબદારી સુરત મહાનગરપાલિકા રહેશે નહીં. કિલ્લાના તમામ નિયમોનાં અર્થવટન માટે અને તેમાંથી ઉપસ્થિત થતી કોઈપણ બાબતમાં મ્યુ.કમિશનરશ્રીનો નિર્ણય આખરી અને બંધનકર્તા ગણાશે. જેના ભંગ બદલ મ્યુ.કમિશનરશ્રી / અધિકૃત અધિકારી દંડ કરી શકશે. પાર્કિંગ ચાર્જિસ જે તે સમયે નક્કી કરવામાં આવેલ હોય તે મુજબ ચૂકવવાના રહેશે. ટીક્રીટબારી છોડતા પહેલા ટીક્રીટ અને પૈસા ચકાસી લેવા. <p>નોંધ:- દરેક પ્રવેશ ફોટો ઓળખકાર્ડ આધારિત રાખવો જરૂરી છે, જેથી ઉપર મુજબ વય મર્યાદાની ચકાસણી કરી શકાય તેમજ સલામતીના ચુસ્ત ધારાધોરણનો અમલ પણ થઈ શકે, ત્વર્ષ સુધીના બાળકો માટે ઓળખકાર્ડ જરૂરી નથી. (ઓળખકાર્ડ સામાન્યતઃ ચુંટણી ઓળખકાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ, ઇન્કમટેક્ષ પાન કાર્ડ વિગેરે), શાળાના વિદ્યાર્થીઓના સંદર્ભે વિદ્યાર્થીઓનું ઓળખ પત્ર તેમજ શાળાના આચાર્ય / જવાબદાર કર્મચારી દ્વારા શાળાના લેટરપેડ પર વિદ્યાર્થીઓની સંખ્યા, નામ અને અભ્યાસનું ઘોરણ જણાવવાનું રહેશે.</p>									
૬	જાહેર તંત્ર અથવા તેના નિયંત્રણ હેઠળની વ્યક્તિઓ પાસેના વિવિધ કક્ષાના દસ્તાવેજોનું પત્રક	અનુ.નં. ૫ ના અનુ. નં. ૧ થી ૫ ઉપરાંત કિલ્લાના રોજીદા વહીવટ દરમ્યાન ઉપસ્થિત થતા અન્ય પેપર્સ									
૭	જાહેર જનતાના પ્રતિનિધિઓ સાથે સલાહસુચનો તથા નીતિ નક્કી કરવા અને તેના અમલ અંગે પ્રસ્થાપિત વ્યસ્થાપિત વ્યવસ્થાની વિગતો	(૧)સાંસ્કૃતિક સમિતિ (૨)સ્થાયી સમિતિ (૩)સામાન્ય સમાન (૪)જાહેર બાંધકામ સમિતિ									
૮	જાહેર તંત્રના બંધારણીય રીતે બે કે તેથી વધુ જાહેરજનતાના પ્રતિનિધિઓની સલાહસુચનો વિગેરે માટે રચાયેલ સમિતિઓની વિગતો	મા..મ્યુનિસિપલ કમિશનરશ્રી ડે.કમિશનરશ્રી ચીફ ક્રૂરેટર ક્રૂરેટર									
૯	અધિકારીઓ તથા કર્મચારીઓની માહિતી પુસ્તીકા	ઓર્ગનાઇઝેશન ચાર્ટર્સ (કાગળો અલગથી અહીં જોડેલ છે.)									
૧૦	અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા પ્રાપ્ત માસિક વળતર અને તેમની પોસ્ટ પ્રમાણે તેમને આપવામાં	<table border="1"> <thead> <tr> <th>હોદ્દો</th> <th>સંખ્યા</th> <th>પગારધોરણ</th> </tr> </thead> <tbody> <tr> <td>ક્રૂરેટર</td> <td>૧</td> <td>૫૬૧૦૦-૧૭૭૫૦૦</td> </tr> <tr> <td>ગેલેરી</td> <td>૧</td> <td>૪૪૮૦૦-૧૪૨૪૦૦</td> </tr> </tbody> </table>	હોદ્દો	સંખ્યા	પગારધોરણ	ક્રૂરેટર	૧	૫૬૧૦૦-૧૭૭૫૦૦	ગેલેરી	૧	૪૪૮૦૦-૧૪૨૪૦૦
હોદ્દો	સંખ્યા	પગારધોરણ									
ક્રૂરેટર	૧	૫૬૧૦૦-૧૭૭૫૦૦									
ગેલેરી	૧	૪૪૮૦૦-૧૪૨૪૦૦									

	આવતું મહેનતાણું.	આસીસ્ટન્ટ પ્રથમ શ્રેષ્ઠી કલાર્ક	૧	૪૪૯૦૦-૧૪૨૪૦૦
		બીજી શ્રેષ્ઠીકલાર્ક (ખાલી)	૧	૪૪૯૦૦-૧૪૨૪૦૦
		ત્રીજી શ્રેષ્ઠી કલાર્ક	૨	૧૫૯૦૦-૬૩૨૦૦
		ઇલેક્ટ્રોનિક વાયરમેન (ઓનલોન-૧)	૩	૨૫૫૦૦-૮૧૧૦૦
		મેઈન્ટેનન્સ આસીસ્ટન્ટ (ઓનલોન)	૧	૩૬૯૦૦-૧૨૬૬૦૦
		એસી.પ્લાન્ટ સાઉન્ડ ઓપરેટર (ખાલી)	૧	૧૫૯૦૦-૬૩૨૦૦
		પટાવાળા	૧૧	૧૫૭૦૦-૫૦૦૦૦
૧૧	તમામ યોજનાઓ, સૂચિત ખર્ચાઓ અને અહેવાલો અંગે ફાળવેલ અંદાજપત્રની વિગતો	સુરત મહાનગરપાલિકાના વિસ્તૃત અંદાજપત્રમાં કિલ્લાનું અંદાજપત્ર		
૧૨	સહાયકી કાર્યક્રમો, ફાળવેલ રકમ સહિતની બાબતો અને લાભાર્થીઓની વિગતો અને તેના અમલની પ્રણાલી.	નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિધાથીઓ અને શિક્ષકો, નારી સંરક્ષણ ગૃહ, અનાથ આશ્રમ, દિવ્યાંગ બાળકો માટેની સંસ્થાઓ, બાળસંરક્ષણ ગૃહના બાળકોને કિલ્લાની મુલાકાત દરમ્યાન વિના મુલ્યે પ્રવેશ આપવામાં આવે છે.		
૧૩	જાહેર તંત્ર દ્વારા આપવામાં આવેલ અધિકૃત પરવાનગીઓ તથા પેશાગી મેળવનારાઓની વિગતો	જાહેર સત્તામંડળ સાથે સંયુક્ત છે. અતેના ખાતાની અલાયદી માહિતી નથી.		
૧૪	વિજાળું રૂપે ઉપલબ્ધ અને સચ્યવાયેલ માહિતીઓની વિગતો	કિલ્લાને લગતી ઇલેક્ટ્રોનિક માહિતી તકનીકી થકી આપવામાં આવે છે અને સોવેનીયર શોપ પણ છે, કે જેમાં પ્રકાશનો અને હસ્તકળાની વસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે.		
૧૫	શહેરજનો ને સરળતાથી માહિતી મળી રહે તે માટે ઉપલબ્ધ સુવિધા, કામના કલાકો, કિલ્લામાં આપવામાં આવતી સુવિધાઓ વિગેરેની વિગતો.	ઓશર કિલ્લાને લગતી માહિતી, કિલ્લાનો સમય, ટીક્કીટનો દર વિગેરે.		
૧૬	જાહેર માહિતી અધિકારીનું નામ અને હોદ્દો અને અન્ય માહિતી	પૃથ્વી એ. રાંગણેકર, કયુરેટર (કિલ્લો)		
૧૭	દર્શાવેલ માહિતીઓ સિવાયની માહિતી અને તેને દરવર્ષ સુધારવા/ઉમેરવા અંગેની વિગતો.			

કિલ્લો, ચોક બજાર, સુરત.

વર્ષ ૨૦૧૫ માં આ ઐતિહાસિક કિલ્લાના સંરક્ષણકાર્યની જવાબદારી ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સુરત મહાનગરપાલિકાને સૌંપવામાં આવેલ સુરત મહાનગરપાલિકા દ્વારા જીણવટભર્યા અભ્યાસ, સંશોધન અને વૈજ્ઞાનિક છબે આકલન કર્યા બાદ સંરક્ષણકાર્યના નિષ્ણાત ઈજારદારોને સંરક્ષણકાર્યની જવાબદારી સોંપી સમગ્ર કામગીરી આયોજનબદ્ધ રીતે આદરવામાં આવી છે. કિલ્લાના ફેઝ-૧ ના સંરક્ષણની કામગીરી પૂર્ણ થતા તા. ૧૩/૦૪/૨૦૧૮ ના રોજ ગુજરાતના તત્કાલીન નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલ. સંપૂર્ણ કિલ્લાનું સંરક્ષણકાર્ય પૂર્ણ થયેથી તા. ૨૮/૦૮/૨૦૨૨ ના રોજ માનવાપ્રધાનશ્રીના વરદ હસ્તે કિલ્લાનું ઈ-લોકાર્પણ કરવામાં આવેલ. કિલ્લાને લગતી માહિતી તેમજ વિગતો નીચે મુજબ છે.

કિલ્લાનો સમય : મંગળવાર થી રવિવાર સવારે ૧૦:૦૦ થી સાંજે ૬:૦૦ સુધી

ટિક્રીટ વેચાણનો સમય : મંગળવાર થી રવિવાર સવારે ૧૦:૦૦ થી સાંજે ૪:૧૦ સુધી

કિલ્લો આખા વર્ષ દરમ્યાન દર સોમવારે તથા કેટલીક રાષ્ટ્રીય અને મુખ્ય જાહેર રજાઓએ બંધ રહેશે.

ફી ના દર :

૩ થી ૧૬ વર્ષ સુધીના બાળકો : રૂ.૫૦

૧૭ થી ૬૦ વર્ષ સુધીના (વયસ્કો) : રૂ.૧૦૦

૬૦ વર્ષથી ઉપરના સિનીયર સિટીઝન : રૂ.૫૦

વિદેશી મુલાકાતિઓ (તમામ વયજીથના) : રૂ.૫૦૦

ડી.એસ.એલ.આર. કેમેરાથી અથવા ભિરરલેસ કેમેરાથી ફોટોગ્રાફી/વિડીયોગ્રાફી : રૂ.૫૦૦

કિલ્લા ખાતે આવતા મુલાકાતીઓ માટેના નીતિ નિયમો:-

(અ) અગત્યની સુચનાઓ :-

અ.નં.	વિગત
(૧)	કિલ્લાની અંદર સ્વચ્છતા જળવાઈ રહે તે હેતુથી કિલ્લાની પ્રિમાઈસીસમાં કોઈપણ ખાદ્ય પદાર્થો, ઠંડા પીણા પાન, મસાલા, ગુટ્ટા, પ્લાસ્ટિકના પાણીના પાઉચ, કેરી બેગ્સ તથા અન્ય પ્રદૂષિત વસ્તુ લઈ જવા દેવામાં આવશે નહિ. બહારના ફરિયાઓને કે સ્વયં સેવકોને કોઈપણ ખાવા પીવાની વસ્તુઓ વેચાણ / વિતરણ કરવા દેવામાં આવશે નહિ.
(૨)	કિલ્લામાં થેલી, મોટુ પાકીટ તથા અન્ય વસ્તુઓ સાથે પ્રવેશ ન કરતા મુલાકાતીઓએ પ્રતિબંધિત સામાન્ય નિયત કલોક રૂમમાં રાખવો પડશે.
(૩)	કિલ્લાની મુલાકાત દરમ્યાન શાંતિ રાખવી, મોબાઇલ ઉપર વાતો કરવાની મનાઈ તેમજ મોબાઇલ સાયલન્ટ મોડ ઉપર રાખવો, થુંકવાની તથા ધુમ્રપાન કરવાની સખત મનાઈ છે. મુલાકાતીઓ જો કિલ્લા ખાતે પાન મસાલા ખાતા પકડાશે કે પીચકારી મારતા પકડાશે તો નિતી નિયમ અનુસાર દંડપાત્ર રહેશે.
(૪)	ફોટોગ્રાફી / વિડીયોગ્રાફીની નક્કી કરેલ નિયત ફી ભરીને ફોટોગ્રાફી / વિડીયો શુટિંગ કરવું.
(૫)	કોઈપણ પ્રકારની ફરિયાદ / સુચનો લેખિતમાં જણાવવા. મુલાકાતીઓએ સ્ટાફ તથા વિવિધ ગેલેરીમાં હાજર રહેલ એટેન્ડન્ટો જોડે વિવેકપૂર્ણ રીતે વર્તવું. ફરિયાદ અથવા સુચન ફરિયાદ બુકમાં લખવા.
(૬)	સિક્યુરિટી સ્ટાફ, ફરજ પરના સ્ટાફ સાથે ગેરવર્તણુંક કે જઘડો કરવો નહિ.
(૭)	પ્રાણીઓ સાથે પ્રવેશ આપવામાં આવશે નહિ.
(૮)	ટિક્રિટ લીધા પણી પ્રવેશ મેળવ્યા બાદ મુલાકાતીઓએ ટિક્રિટ કિલ્લાને છોડતા સુધી પોતાની પાસે રાખવાની રહેશે.
(૯)	કિલ્લાનો સમય મ્યુ. કમિશનરશ્રી વખતો વખત નક્કી કરે, એ મુજબનો રાખવામાં આવશે.
(૧૦)	અસભ્ય વર્તન કરનાર, માદક પીણા પીનાર તેમજ માવા-ગુટ્ટા ખાનારને બહાર કાઢી મુકવાની સત્તા અધિકૃત અધિકારીશ્રીની રહેશે.
(૧૧)	એક વખત ટિક્રિટ લીધા બાદ કે કાઉન્ટર છોડ્યા બાદ ટિક્રિટ પરત લેવામાં આવશે નહિ કે નાણા પરત આપવામાં આવશે નહિ.
(૧૨)	સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ સમિતિના વિધાર્થીઓને કિલ્લાની મુલાકાત દરમ્યાન પ્રવેશ શુલ્કમાં સંપૂર્ણ મારી મળશે.
(૧૩)	નારી સંરક્ષણ ગૃહ, અનાથ આશ્રમ, ટિવ્યાંગ બાળકો માટેની સંસ્થાઓ, બાળસંરક્ષણ ગૃહના બાળકોને કિલ્લાની મુલાકાત દરમ્યાન પ્રવેશ શુલ્કમાં સંપૂર્ણ મારી મળશે.
(૧૪)	કુદરતી રીતે અગર જાહેર સુલેહ શાંતિ જોખમાય તેવા અસામાન્ય સંજોગોમાં કિલ્લો બંધ કરવાની પરિસ્થિતિ

	ઉભી થાય તો તેવા સંજોગોમાં પ્રવેશ ટીકીટની પુરેપુરી રકમનું રીફ્ડ આપવાની અથવા તારીખની ફેરબદલી કરી આપવા અંગે મ્યુ.કમિશનરશ્રી કે તેમના અધિકૃત અધિકારીશ્રીનો નિર્ણય આખરી અને બંધનકર્તા રહેશે.
(૧૫)	કિલ્લાની મિલકતને કે પ્રદર્શિત કરેલ કલાકૃતિને કોઈપણ પ્રકારનું નુકશાન થાય તો મ્યુ.કમિશનરશ્રી અથવા અધિકૃત અધિકારીશ્રી તેની કરેલ આકારણીની દંડ સહિત એટલે કે થયેલ નુકશાની મુલાકાતી પાસેથી વસુલ કરી શકશે, અન્યથા જરૂર જણાય તો પોલીસ કાર્યવાહી કરવાને પાત્ર રહેશે.
(૧૬)	કિલ્લાની મુલાકાત દરમ્યાન આકસ્મિક સંજોગોમાં દુર્ઘટના સર્જાય અને તેના થકી કોઈપણ મુલાકાતીને નુકશાન થાય તો તેની જવાબદારી સુરત મહાનગરપાલિકાની રહેશે નહીં.
(૧૭)	કિલ્લાના તમામ નિયમોના અર્થધટન માટે અને તેમાંથી ઉપસ્થિત થતી કોઈપણ બાબતમાં મ્યુ.કમિશનરશ્રીનો નિર્ણય આખરી અને બંધનકર્તા ગણાશે. જેના ભંગ બદલ મ્યુ.કમિશનરશ્રી / અધિકૃત અધિકારી દંડ કરી શકશે.
(૧૮)	પાર્કિંગ ચાર્જિસ જે તે સમયે નક્કી કરવામાં આવેલ હોય તે મુજબ પાર્કિંગમાં ચુકવવાના રહેશે.

નોંધ:- દરેક પ્રવેશ ફોટો ઓળખકાર્ડ આધારીત રાખવો જરૂરી છે, તેથી ઉપર મુજબ વય મર્યાદાની ચકાસણી કરી શકાય તેમજ સલામતીના ચુસ્ત ધારાધોરણનો અમલ પણ થઈ શકે. તુ વર્ષ સુધીના બાળકો માટે ઓળખકાર્ડ જરૂરી નથી. (ઓળખકાર્ડ સામાચા: આધાર કાર્ડ, ચુંટણી ઓળખકાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ, ઇન્કમટેક્સ પાન કાર્ડ વિગેરે) શાળાના વિધાર્થીઓના સંદર્ભે વિધાર્થીઓનું ઓળખપત્ર તેમજ શાળાના આચાર્ય/જવાબદાર કર્મચારી દ્વારા શાળાના લેટરપેડ પર વિધાર્થીઓની સંખ્યા, નામ અને અભ્યાસનું ધોરણ જણાવવાનું રહેશે.

આર્ટ ગેલેરી કમ એક્ઝિબિશન હોલ અને કોન્ફરન્સ રૂમના નિતિ નિયમો:

:: બુક્ઝિગ અંગેના નિયમો ::

અ.નં.	વિગત
(૧)	સુરત મહાનગરપાલિકા સંરક્ષિત ચોક સ્થિત કિલ્લામાં આવેલ આર્ટ ગેલેરી કમ એક્ઝિબિશન હોલ અને કોન્ફરન્સ રૂમનો ઉપયોગ કરવા ઈચ્છતી કોઈ પણ સંસ્થા અગર વ્યક્તિએ ચોક સ્થિત કિલ્લાની કચેરીએ રૂખરૂ આવીને રાષ્ટ્રીય, જાહેર રજાના દિવસો તેમજ સોમવાર સિવાય મંગળવાર થી રવિવાર દરમ્યાન સવારના ૧૧:૩૦ થી ૨:૩૦ કલાક સુધીમાં નિયત ડિપોઝિટ તથા ડોક્યુમેન્ટ રજૂ કરી બુક્ઝિગ કરી શકાશે.
(૨)	(અ) ચોક સ્થિત કિલ્લામાં આવેલ આર્ટ ગેલેરી કમ એક્ઝિબિશન હોલ અને કોન્ફરન્સ રૂમનો ઉપયોગ જે તારીખે કરવાનો હોય તે તારીખથી વધુમાં વધુ ૧૫૦ દિવસ અને ઓછામાં ઓછા ૦૭ દિવસ અગાઉ અરજી કરવાની રહેશે. આ સમય મર્યાદામાં ફેરફાર કરવાની સત્તા કમિશનરશ્રી અથવા તેમના અધિકૃત અધિકારીને રહેશે.
	(બ) ચોક સ્થિત કિલ્લામાં આવેલ નિર્દિષ્ટ જગ્યાનો ઉપયોગ જે તારીખે કરવાનો હોય તે તારીખથી ઉપર જણાવેલ આગણ-પાછળની સમય મર્યાદા જોઈ તપાસી વહેલા તે પહેલાના ઘોરણે એડવાન્સ બુક્ઝિગ કરવામાં આવશે તેમજ ભાડું તથા એસી ચાર્જિસ ઉપરાંત આ બંને ચાર્જિસના ૧૦૦% મુજબની ડિપોઝિટની રકમ અગાઉથી જમા કરાવી બુક્ઝિગ કરાવવાનું રહેશે.
(૩)	જો કોઈ તારીખે કોઈપણ સંસ્થા યા વ્યક્તિત્વ તરફથી આર્ટ ગેલેરી કમ એક્ઝિબિશન હોલ અને કોન્ફરન્સ રૂમ અગાઉથી રીજર્વેશન મેળવવામાં આવ્યું હશે તેમ છતાં કોઈ અનિવાર્ય સંજોગો ઉભા થાય અથવા સરકારી કે અર્ધસરકારી કાર્યક્રમનું આયોજન કરવાનું થાય તો તેવું રીજર્વેશન કોઈપણ કારણો જણાવ્યા સિવાય રદ કરવાની સત્તા સુરત મ્યુ. કમિશનરશ્રીની રહેશે. રીજર્વેશન રદ કરવા બદલ કોઈપણ નુકશાની ચુકવવાની થતી જવાબદારી મહાનગરપાલિકાની રહેશે નહીં તથા તે અંગે કોઈપણ જાતની તકરાર ચાલશે નહીં. સદર કિસ્સામાં રીજર્વેશન રદ કરવા બદલ ભાડા તેમજ ડિપોઝિટની રકમ સંપૂર્ણ રીફંડ કરવામાં આવશે. આ ઉપરાંત સદર સંજોગોમાં કાર્યક્રમ આયોજિત કરવા અન્ય તારીખ / સેશનની માંગણી કરે તો ઉપલબ્ધતા અનુસાર વિનામૂલ્યે તારીખ / સેશન બદલવાની સત્તા વિભાગીય વડાને રહેશે.
(૪)	કોઈપણ સંસ્થા અગર વ્યક્તિને સણંગ ૧૫ દિવસથી વધુ સમય માટે આર્ટ ગેલેરી કમ એક્ઝિબિશન હોલ અને કોન્ફરન્સ રૂમ વાપરવા માટેનું રીજર્વેશન મળી શકશે નહીં. તેમ છતાં જો આવી કોઈ માંગણી આવે તો તેવા સંજોગોમાં યોગ્યતા મુજબ ફાળવણી કરવાની સત્તા મ્યુનિ. કમિશનરશ્રીની રહેશે.
(૫)	અરજદાર દ્વારા ચોક સ્થિત કિલ્લા ખાતે ભાડે રાખેલ જગ્યાનું બુક્ઝિગ કરાવ્યા બાદ જો કોઈ સંજોગોમાં તેઓ દ્વારા કાર્યક્રમનું બુક્ઝિગ રદ કરવા માટેની લેખિત અરજી કરવામાં આવે તો તેવા સંજોગોમાં નીચે જણાવેલ દરે આયોજકની ડિપોઝિટમાંથી તેની સમય મર્યાદા અનુસાર કેન્સલેશન ચાર્જિસ તેમજ લાગત વેરા વસૂલ લઈ બાકીની રકમ અરજદારને પરત કરવામાં આવશે. વસૂલ લીધેલ કેન્સલેશન ચાર્જિસ બાબતે અરજદાર તરફથી કોઈ વાંધો કે તકરાર ઉપસ્થિત કરી શકાશે નહીં.

કાર્યક્રમ રદ કરવા બાબતે વસૂલ લેવા જોગ કેન્સલેશન ચાર્જીસની વિગત

અ.નં.	કાર્યક્રમના દિવસ અગાઉ	ભાડાની રકમમાંથી વસૂલ લેવા જોગ કેન્સલેશન ચાર્જીસ
૧.	૧૨૧ દિવસ કે તેથી વધુ દિવસ	૨૫ %
૨.	૩૧ દિવસ થી ૧૨૦ દિવસ સુધી	૫૦ %
૩.	૧૬ દિવસ થી ૩૦ દિવસ સુધી	૭૦ %
૪.	૮ દિવસ થી ૧૫ દિવસ સુધી	૬૦%
૫.	૭ દિવસ કે તેની અંદર	૧૦૦%

(૭)	બુકીગમાં જે વ્યકિત અગર સંસ્થાનું નામ કાર્યક્રમના પ્રાયોજક તરીકે દર્શાવવામાં આવ્યું હશે તેમાં કોઈપણ સંજોગોમાં ફેરફાર કરવા દેવામાં આવશે નહીં અર્થાત પ્રાયોજક સિવાયની કોઈપણ અન્ય ત્રાહિત વ્યકિત તે કાર્યક્રમ અંગે આર્ટ ગેલેરી કમ એક્ઝિબિશન હોલ અને કોન્ફરન્સ રૂમ ભાડે રાખનાર કોઈ બીજાને પેટા ભાડે આપી શકશે નહીં અથવા નામ ફેર કરી શકશે નહીં. અરજદાર સિવાયની કોઈપણ અન્ય વ્યકિત કે સંસ્થા દ્વારા કાર્યક્રમ યોજવા દેવામાં આવશે નહીં. આ નિયમનો ભંગ કર્યાનું માલુમ પડશે તો સબંધકર્તા વ્યકિત અગર સંસ્થા દ્વારા આ અરજી સાથે ભરવામાં આવેલી તમામ રકમ જપ્ત કરવામાં આવશે તથા રીજર્વેશન આપોઆપ રદ થયેલું ગણાશે. આપ્યોજક નિયમોનો ઈરાદાપૂર્વક ભંગ કરશે તો તેમને કાળી યાદીમાં મૂકવામાં આવશે અને અરજી સાથે ભરેલ ડીપોઝિટ જપ્ત કરવામાં આવશે.
(૮)	કુદરતી આફિત અગર જાહેર સુલેહ શાંતિ જોખમાય તેવા અસામાન્ય સંજોગોમાં કાર્યક્રમ રદ કરવાની પરિસ્થિતિ ઉભી થાય તો તેવા સંજોગોમાં ડીપોઝિટ તથા ચાર્જીસની પૂરેપુરી રકમનું રીફંડ આપવાની સત્તા મ્યુનિ.કમિશનરશીને રહેશે.
(૯)	કાર્યક્રમ ચાલુ હોય તે સમય દરમાન કુદરતી આફિત અગર જાહેર સુલેહ શાંતિ જોખમાય તેવા સંજોગોમાં કાર્યક્રમ અડદ્યેથી બંધ કરાવવાની સત્તા વિભાગીય વડાશ્રીને રહેશે અને તે માટે કોઈ રીફંડ આપવામાં આવશે નહીં.
(૧૦)	કોઈપણ કાર્યક્રમ માટે આર્ટ ગેલેરી કમ એક્ઝિબિશન હોલ / કોન્ફરન્સ રૂમ વાપરવાની પરવાનગી આપવી કે નહીં તે બાબતનો નિર્ણય કરવાની સત્તા મ્યુનિ. કમિશનરશી અથવા તેમના અધિકૃત અધિકારીશ્રીને રહેશે.
(૧૧)	કોઈપણ પ્રકારના મેજર રીપેરીંગ, મેઈન્ટેનન્સ કે, અન્ય કોઈ કારણોસર જરૂરી કામગીરી હેતુ આર્ટ ગેલેરી કમ એક્ઝિબિશન હોલ / કોન્ફરન્સ રૂમ ફાળવી શકાય એમ ન હોય તો જે તે સમય માટે આર્ટ ગેલેરી કમ એક્ઝિબિશન હોલ / કોન્ફરન્સ રૂમનાં બુકીગની કાર્યવાહી હંગામી ધોરણે મોકુફ રાખવા સારુ વિભાગીય વડાશ્રી અધિકૃત રહેશે.
(૧૨)	આર્ટ ગેલેરી કમ એક્ઝિબિશન હોલ અને કોન્ફરન્સ રૂમનો ઉપયોગ કરવા માટે મનોરંજન લાઈસન્સ, કોપીરાઇટ અને ટ્રેડ માર્ક તથા અન્ય લાગુ તમામ કાયદાઓ તથા નિયમોનું ચુસ્ત પણે પાલન કરવાનું રહેશે તથા જેના ભંગ અંગેની સંપૂર્ણ જવાબદારી પ્રાયોજકોની રહેશે.

:: આર્ટ ગેલેરી કમ એક્ઝિબિશન હોલ અને કોન્ફરન્સ રૂમનો ઉપયોગ કરવા સંબંધી નિયમો ::

(૧)	ભાડે રાખેલ નિર્દિષ્ટ જગ્યા માટે જાહેર જનતાની જાણ માટે જાહેરાતનું એક બોર્ડ (સાઈઝ : ૪ ફૂટ × ૨ ફૂટ) જે તે સ્થળના પ્રવેશદાર ઉપર કાર્યક્રમના દિવસે મુકવા દેવામાં આવશે. જે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વ્યક્તિ / સંસ્થા / પ્રાયોજક દ્વારા તે જ દિવસે પરત લઈ જવાનું રહેશે. વધુમાં વધુ ૨(બે) બેનર વિના મૂલ્યે નિર્દિષ્ટ જગ્યાએ પ્રદર્શિત કરવા દેવામાં આવશે. જ્યારે ૨(બે) થી વધુ બેનર હશે તો પ્રતિ બેનર દિન રૂ. ૧૦૦/- (સાઈઝ : ૪ ફૂટ × ૨ ફૂટ) વસુલવામાં આવશે. સદર બોર્ડ / બેનર મુકવા માટે યોગ્ય જગ્યા નક્કી કરવાની સત્તા ખાતાકીય વડાની રહેશે.
(૨)	ચોક સ્થિત કિલ્લા ખાતે કાર્યક્રમનું આયોજન કરનાર આયોજક દ્વારા પાર્કિંગના નક્કી કરેલ દરે વાહન પાર્કિંગની જગ્યાનો ઉપયોગ કરવાનો રહેશે. નિર્દિષ્ટ જગ્યા ભાડે રાખનાર આયોજક / વ્યક્તિ / સંસ્થાએ પરિસરમાં જ આવેલ સુરત મહાનગરપાલિકા નિયુક્ત એજન્સી / ઈજારદાર સંચાલિત 'પે એન્ડ પાર્ક' પાર્કિંગ સુવિધાનો ઉપયોગ કરવાનો રહેશે તેમજ કિલ્લાની પ્રિમાઈસીસમાં અન્ય કોઈ પણ સ્થળે પાર્કિંગ કરાવી / કરી શકશે નહી તેમજ જો પાર્કિંગનો ઈજારો આપવામાં આવેલ ન હોય ત્યારે આયોજકે પોતે સ્વયં સેવક રાખી ફી પાર્કિંગ કરાવવાનું રહેશે તથા કિલ્લાનાં સંકુલમાં ખાદ્ય પદાર્થનો સ્ટોલ કે કેન્ટીન કરવા દેવામાં આવશે નહી.
(૩)	કોન્ફરન્સ રૂમમાં નિર્ધારીત બેઠક ક્ષમતા સિવાય વધારાની ૨૦ ખુરશીઓ મુકવા દેવામાં આવશે તેમજ ક્ષમતા કરતાં વધુ પ્રેક્શકોને પ્રવેશ આપી શકશે નહી અને જો વધારાની વ્યક્તિઓએ પ્રવેશ મેળવેલ હશે તો નિયમ ભંગ કરવા બદલ શિક્ષા/દંડ કરવાની સત્તા ખાતાકીય વડાશીને રહેશે.
(૪)	જો આર્ટ ગેલેરી કમ એક્ઝિબિશન હોલ / કોન્ફરન્સ રૂમમાં ઉપલબ્ધ જનરેટરનો ઉપયોગ કરવામાં આવે તો પ્રતિ યુનિટ નિયત કરેલ ચાર્જ વસુલ કરવામાં આવશે.
(૫)	કાર્યક્રમોના પ્રકાર / ઉપયોગીતા પ્રમાણે જો વધારાની ડીપોઝીટ લેવાની જરૂરાય તો તેની સત્તા ખાતાવિકારીને રહેશે.

:: પ્રાયોજકની જવાબદારી અને ફરજો ::

(૧)	કોઈ પ્રાયોજક તેના કાર્યક્રમ માટે પોતે જે કોઈ પોતાની સાધન-સામગ્રી સેટીંગ, ફર્નિચર તથા લાઈટ અંગેની સામગ્રીઓ લાવે તો પ્રાયોજક તેવી વસ્તુઓની યાદી ખાતાવિકારી અથવા કિલ્લા ખાતે ઉપલબ્ધ સ્ટાફને આપી તેવી વસ્તુઓ તેમને રૂબરૂ બતાવવાની રહેશે તથા કાર્યક્રમ બાદ આવી વસ્તુઓ નિર્ધારીત સમય મર્યાદામાં બતાવીને લઈ જવાની રહેશે. વધુમાં વધારાના સાધનો લાવવા માટે જરૂરી જાણ/પરવાનગી અગાઉથી લેવાની રહેશે. સાધન સામગ્રી ગુમ થવા કે નુકશાન થવા બાબતે સુરત મહાનગરપાલિકાની કોઈ જવાબદારી રહેશે નહી અને સાધન સામગ્રી પરત લઈ જવામાં થયેલ વિલંબ બદલ દંડ પેટે આયોજકની ડીપોઝીટમાંથી ચાર્જ વસુલ લેવાની સત્તા ખાતાવિકારીશીને રહેશે.
(૨)	કાર્યક્રમ અંગે વધારાનું ફર્નિચર, વિગેરેની પ્રયોજકોને જરૂરી હશે તો તેવી જરૂરિયાત અંગે કાર્યક્રમના બે દિવસ અગાઉથી અરજી કરવાની રહેશે. જે અનુસાર જે સાધન-સામગ્રી ઉપલબ્ધ હશે તેની નિર્ધારીત ભાડાની રકમ ડીપોઝીટમાંથી વસુલ લઈ તેવી સામગ્રી ઉપલબ્ધ કરવામાં આવશે. આવી તમામ સાધન સામગ્રી કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તરત જ સહી સલામત પરત કરવાની પ્રાયોજકની જવાબદારી રહેશે. આ સામગ્રીને થયેલ નુકશાનીની રકમ ડીપોઝીટમાંથી કાપી લેવામાં આવશે.
(૩)	ચોક સ્થિત કિલ્લાના આર્ટ ગેલેરી કમ એક્ઝિબિશન હોલ / કોન્ફરન્સ રૂમની લાઈટ, સાઉન્ડ, એ.સી. પ્લાન્ટ,

	દ્રશ્ય-શાય ઉપકરણો વિગેરેના નિયંત્રણ વિસ્તારમાં અવિકૃત ઓપરેટર સિવાય અન્ય કોઈ વ્યક્તિને પ્રવેશ આપવામાં આવશે નહીં.
(૪)	કાર્યક્રમમાં ભાગ લેનાર મહાનુભાવો તેમજ આમંત્રિતો સિવાયની કોઈપણ અન્ય વ્યક્તિને પ્રાયોજકે દાખલ થવા દેવાના નહીં. આવી બિનજરૂરી વ્યક્તિઓને મેનેજમેન્ટ કિલ્લાની પ્રિમાઈસથી દૂર કરી શકશે. કાર્યક્રમ સાથે સીધી રીતે સંકળાયેલ વ્યક્તિઓની ઓળખ માટે પ્રાયોજકે બેચ/સ્ટીકર પુરા પાડવાના રહેશે. જે ધારણા કર્યા સિવાયની વ્યક્તિઓને પ્રવેશ મળી શકશે નહીં. આર્ટ ગેલેરી કમ એક્ઝિબિશન હોલ / કોન્ફરન્સ રૂમમાં આવનાર આમંત્રિત / મુલાકાતી/ અન્ય કોઈપણ વ્યક્તિ નિર્ધારીત જગ્યા સિવાય કિલ્લાની મુલાકાત તેમજ વિરીયોગ્રાફી / ફોટોગ્રાફી નિર્ધારીત ટીક્સીટ લીધા વિના કરી શકશે નહીં.
(૫)	કાર્યક્રમના પ્રારંભથી અંત સુધી પ્રાયોજકે પોતાના તરફથી ઓળખ માટે બેજ ધારણા કરેલા સ્વયંસેવકોને આર્ટ ગેલેરી કમ એક્ઝિબિશન હોલ / કોન્ફરન્સ રૂમમાં રાખવાના રહેશે તથા સ્વયંસેવકોના નામની યાદી ખાતાવિકારીશ્રીને કાર્યક્રમના અગાઉના દિવસે પ્રાયોજકે આપવાની રહેશે.
(૬)	કાર્યક્રમ યોજવા અંગે જે તે સમયે પ્રવર્તમાન કાયદાકીય જોગવાઈઓ મુજબ તમામ જરૂરી પરવાનગીઓ સંબંધિત સરકારી/અર્ધસરકારી કચેરીઓમાંથી મેળવીને આયોજક દ્વારા કાર્યક્રમ શરૂ કરતા અગાઉ કિલ્લાના અવિકારીશ્રી સમક્ષ રજૂ કરવાની રહેશે. જે સિવાય કાર્યક્રમ યોજી શકશે નહીં.
(૭)	આર્ટ ગેલેરી કમ એક્ઝિબિશન હોલ / કોન્ફરન્સ રૂમનો ના કાર્યક્રમ માટે કબજો લેતી વખતે કિલ્લા ખાતે ઉપસ્થિત કર્મચારીની હાજરીમાં તમામ સાધન-સામગ્રી, બેઠકો વિગેરે તપાસી લઈ નિર્ધારીત પત્રકમાં પ્રાયોજકે સહી કરવાની રહેશે. આગ, હુલ્લડ, ધાંધલ અથવા બીજા અન્ય કારણો આર્ટ ગેલેરી કમ એક્ઝિબિશન હોલ / કોન્ફરન્સ રૂમના માલ મિલકત, વીજળી જોડાણો, અન્ય સાધનો, ખુરશીઓ તથા કિલ્લાની મિલકતને નુકશાન થાય કે ગુમ થાય તેવા કિસ્સામાં ભૂનિ. કમિશનરશ્રી અથવા અવિકૃત અવિકારીશ્રી નકદી કરે તેવી નુકશાનીની રકમ આર્ટ ગેલેરી કમ એક્ઝિબિશન હોલ / કોન્ફરન્સ રૂમ ભાડે રાખનાર પાસેથી વસુલ લેવામાં આવશે. નુકશાનીની આકારણી કરવામાં આવેલ નિર્ણય છેવટનો રહેશે. જમા કરેલ ડીપોઝીટની રકમ કરતાં નુકશાનીની રકમ તથા કાર્યક્રમ દરમ્યાન થયેલ ખર્ચની લેણી રકમ વધુ થાય તો અરજદારે તાકીદે રોકડમાં ભરપાઈ કરવાની રહેશે. મુદ્દત વિન્યે ભૂનિ. કમિશનરશ્રી સુરત મહાનગરપાલિકાના માંગણા મુજબ વસુલ કરવા હક્કદાર રહેશે તેમજ આ અંગે જરૂર પડ્યેથી બીજા કાયદેસરના પગલાં લઈ શકશે. આ અંગે કોર્ટમાં દાવો ચલાવવા ફક્ત સુરત સીવીલ કોર્ટનું જયુરીડીક્ષણ રહેશે. (Subject To Surat Jurisdiction Only)
(૮)	પ્રેક્ષક્રમાં કોઈપણ જાતની છેતરામણી જાહેરાત પ્રાયોજકે કે તેના પ્રતિનિધિઓએ કોઈપણ રીતે કરવાની નથી. આ પ્રકારની છેતરામણી જાહેરાતના પરિણામે આર્ટ ગેલેરી કમ એક્ઝિબિશન હોલ / કોન્ફરન્સ રૂમમાં કાર્યક્રમ દરમ્યાન ધમાલ થાય અને તેથી હોલની માલ-મિલકતને નુકશાન થાય નહીં તે માટેની તમામ જવાબદારી પ્રાયોજકની રહેશે. આ પ્રકારની છેતરામણીભરી જાહેરાતના પરિણામે આર્ટ ગેલેરી કમ એક્ઝિબિશન હોલ / કોન્ફરન્સ રૂમનાં કાર્યક્રમ દરમ્યાન કાયદો અને વ્યવસ્થાની જાળવણીને લગતા પ્રશ્નો ઉપસ્થિત થશે તો તેવા સંજોગોમાં તમામ જવાબદારી આયોજકની રહેશે અને કિલ્લાના અવિકારીશ્રીને જરૂર જણાય તો કાર્યક્રમ અધવર્યે જ પૂર્ણ થયેલો જાહેર કરી શકશે.
(૯)	આર્ટ ગેલેરી કમ એક્ઝિબિશન હોલ / કોન્ફરન્સ રૂમનો ઉપયોગ કરનાર વ્યક્તિ / સંસ્થા દ્વારા આયોજક વ્યક્તિ / સંસ્થાની રહેશે.
(૧૦)	ચોક સ્થિત કિલ્લાની પ્રિમાઈસીસની અન્ય જગ્યા પર કોઈપણ પ્રકારનું સુશોભન કિલ્લાના અવિકારીશ્રીની જાણ વિના કરી શકશે નહીં કે સુશોભન માટે ખીલી, સેલોટેપ વિગેરેનો ઉપયોગ કરી શકશે નહીં તેમજ આર્ટ ગેલેરી કમ એક્ઝિબિશન

	હોલ / કોન્ફરન્સ રૂમમાં નિર્દિષ્ટ જગ્યા સિવાય સુશોભન કરી શકશે નહીં કે બેનર મુકી શકશે નહીં.
(૧૧)	આર્ટ ગેલેરી કમ એક્ઝિબિશન હોલ / કોન્ફરન્સ રૂમમાં રજુ થનાર કોઈપણ કાર્યક્રમમાં ફટાકડા, દારૂખાનુ, મશાલ તથા અન્ય સણગી ઉઠે તેવા પદાર્થો, અગ્નિની જવાળાઓ થાય તેવા પ્રયોગો, જોખમકારક સ્ફોટક પદાર્થો તથા દ્રવ્યોનો ઉપયોગ કરવા દેવામાં આવશે નહીં. જે અનુસાર સણગે તેવા, ઘડાકો થાય તેવા પદાર્થો, ધૂમાડો થાય તેવા ધૂપ-દિપ તથા જોખમી રંગ રસાયણો, ગુલાલ વિગેરે કિલ્વામાં લાવી કે રાખી શકશે નહીં જેના ભંગ બદલ ઉભી થતી તમામ જવાબદારી પ્રાયોજકની રહેશે.
(૧૨)	આર્ટ ગેલેરી કમ એક્ઝિબિશન હોલ / કોન્ફરન્સ રૂમ ભાડે રાખનાર વ્યક્તિ / સંસ્થા કાર્યક્રમ માટે અન્ય એજન્સીઓને કામે રોકે અથવા તો પોતાની સંસ્થાના કર્મચારી કે કામદારો પાસે કામગીરી કરાવે અને તે દરમ્યાન તેઓને જો કોઈ આક્સિમક ઈજા થાય તો તેવા સંજોગોમાં WORKMAN COMPENSATION ની જવાબદારી આર્ટ ગેલેરી કમ એક્ઝિબિશન હોલ / કોન્ફરન્સ રૂમ ભાડે રાખનાર વ્યક્તિ / સંસ્થાની રહેશે. WORKMAN COMPENSATION અંગે સુરત મહાનગરપાલિકાની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહીં.
(૧૩)	આર્ટ ગેલેરી કમ એક્ઝિબિશન હોલ / કોન્ફરન્સ રૂમનો ઉપયોગ કરનાર વ્યક્તિ / સંસ્થા અને / અથવા તેમના આમંત્રિત મહેમાનો દ્વારા સાથે લાવવામાં આવેલ રોકડ રકમ અને / અથવા અન્ય કિંમતી ચીજ વસ્તુઓ ગુમ થાય કે નુકશાન થાય તો તે અંગે સુરત મહાનગરપાલિકા જવાબદાર રહેશે નહીં.

ઃ સામાન્ય નિયમો ૩

(૧)	આર્ટ ગેલેરી કમ એક્ઝિબિશન હોલ / કોન્ફરન્સ રૂમની અંદર સ્વચ્છતા જણવાઈ રહે તે જ હેતુથી આર્ટ ગેલેરી કમ એક્ઝિબિશન હોલ / કોન્ફરન્સ રૂમમાં કોઈપણ પ્રકારના ખાદ્ય પદાર્થો, ઠંડાપીણા, પાનમસાલા, ગુટખા લઈ જવા દેવામાં આવશે નહીં. બહારના ફેરીયાઓને કે સ્વંયસેવકોને કોઈપણ ખાવાપીવાની વસ્તુઓ વેચાણ / વિતરણ કરવા દેવામાં આવશે નહીં. આર્ટ ગેલેરી કમ એક્ઝિબિશન હોલ / કોન્ફરન્સ રૂમની અંદર આવી ચીજ-વસ્તુઓ લઈ જવાની સખત મનાઈ છે. જેના ભંગ બદલ તેના ખાતાધિકારીશ્રી દંડ કરી શકશે. આ વ્યવસ્થા જણવાઈ રહે તે બાબત આયોજકે પ્રેક્ષકો આર્ટ ગેલેરી કમ એક્ઝિબિશન હોલ / કોન્ફરન્સ રૂમમાં જાય ત્યારે પોતાના વોલેન્ટીયર્સ દ્વારા ચેકીંગ કરાવી, આવી ચીજવસ્તુઓ આર્ટ ગેલેરી કમ એક્ઝિબિશન હોલ / કોન્ફરન્સ રૂમમાં ન જાય તે બાબતે આયોજન કરવાનું રહેશે.
(૨)	કિલ્વા સાથે સંકળાયેલ સ્ટાફ, મ્યુનિ.કમિશનરશ્રીએ જે અધિકારીશ્રીને અધિકાર આપ્યો હોય તેવા કર્મચારીઓ તથા સુરત મહાનગરપાલિકાના પદાધિકારીશ્રીઓ આર્ટ ગેલેરી કમ એક્ઝિબિશન હોલ / કોન્ફરન્સ રૂમના વપરાશ દરમ્યાન કોઈપણ ભાગમાં પ્રવેશ કરી શકશે.
(૩)	અણવાયા કે આક્સિમક સંજોગોમાં આર્ટ ગેલેરી કમ એક્ઝિબિશન હોલ / કોન્ફરન્સ રૂમની સુવિધામાં એરકન્ડીશન, સાઉન તથા ઇલોક્ટ્રોિક પાવર વિગેરે કોઈપણ જાતનો વિક્ષેપ થાય તો તે માટે મહાનગરપાલિકાની જવાબદારી રહેશે નહીં.
(૪)	આર્ટ ગેલેરી કમ એક્ઝિબિશન હોલ / કોન્ફરન્સ રૂમમાં યોજાયેલ કોઈ કાર્યક્રમમાં કોપી રાઈટનો ભંગ થતો હશે તો તે માટે મહાનગરપાલિકાની જવાબદારી રહેશે નહીં.

(૪)	આર્ટ ગેલેરી કમ એક્ઝિબિશન હોલ / કોન્ફરન્સ રૂમમાં આયોજીત કોઈપણ કાર્યક્રમ દરમ્યાન આયોજકો દ્વારા Intellectual Property Rights (બૌદ્ધિક સંપત્તિ અધિકાર) ના અમલ બાબતે પૂરતી તકેદારી રાખવાની રહેશે અને જરૂર જણાય તો સંબંધિત વ્યક્તિ/સંસ્થાની લેખિત સંમતિ/પરવાનગી પણ મેળવવાની રહેશે. Intellectual Property Rights (બૌદ્ધિક સંપત્તિ અધિકાર) નો કોઈપણ પ્રકારે ભંગ થયેથી ઉપસ્થિત થનાર પરિસ્થિતિની સઘણી જવાબદારી આયોજકોની રહેશે અને સુરત મહાનગરપાલિકાની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં.
(૫)	સુરત મહાનગરપાલિકા દ્વારા આર્ટ ગેલેરી કમ એક્ઝિબિશન હોલ / કોન્ફરન્સ રૂમને વિવિધ કાર્યક્રમો માટે ફાળવવામાં આવશે જે કરવા બાબતે કેન્દ્રસરકાર / રાજ્યસરકાર / સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા / પોલીસ વિભાગના લાગુ પડતા કાયદાઓ મુજબ જે કાંઈ અન્ય લાયસન્સ / પરવાનગી / મંજુરી લેવાની થતી હોય તો તે આયોજકે પોતાના ખર્ચે અને જોખમે સંબંધિત ખાતાઓ / વિભાગમાં અરજી કરી મેળવવાના રહેશે, આવા કાયદાઓના ભંગ થશે તે અંગેની સઘણી જવાબદારી આયોજકની રહેશે.
(૬)	આર્ટ ગેલેરી કમ એક્ઝિબિશન હોલ / કોન્ફરન્સ રૂમ લગ્ન કે લગ્નના સંબંધી કે તેને સંલગ્ન કોઈ પણ કાર્યક્રમ તથા શ્રદ્ધાજલી વિગેરે જેવા કાર્યક્રમ માટે ભાડે આપવામાં આવશે નહીં.
(૭)	આર્ટ ગેલેરી કમ એક્ઝિબિશન હોલ / કોન્ફરન્સ રૂમમાં ૨જૂ કરવામાં આવનાર કાર્યક્રમની રૂપરેખા, પ્રવચનો, વ્યાખ્યાનો, પરિસંવાદો વિગેરે અંગેની સઘણી લેખિત માહિતી કિલ્લાના વિભાગીય વડાશ્રી આયોજક પાસે કાર્યક્રમ અગાઉ માંગી શકશે અને જો તે આપવામાં નહીં આવે તો તેવા સંજોગોમાં આર્ટ ગેલેરી કમ એક્ઝિબિશનહોલ / કોન્ફરન્સ રૂમનો ઉપયોગ પ્રતિબંધિત કરવા માટે તેઓશ્રી સક્ષમ રહેશે.
(૮)	કાર્યક્રમ અંગેની જાહેર ખખર, આમંત્રણ પત્રિકા કે ટીકીટો છપાવવામાં આવે તો તેના ઉપર ચોક સ્થિત કિલ્લાનું નામ, તથા પ્રાયોજક જે નામથી બુકીંગ કરાવે તે નામ આમંત્રણ પત્રિકામાં ફરજીયાત લખવાનું રહેશે. વધુમાં તેજ નામે રીફ્ડ કરવામાં આવનાર હોય તેજ નામનું બેક એકાઉન્ટ હોવું જરૂરી છે.
(૯)	ઓનલાઈન બુકીંગ કરાવ્યાના દિન-૨ માં ઓળખ તથા રહેઠાણના પુરાવા તરીકે નીચે મુજબના પુરાવા પૈકીના કોઈ પણ એક પુરાવાની નકલ તથા રીફ્ડ માટે કેન્સલ ચેકની નકલ કિલ્લા ખાતે રજૂ કરવાની રહેશે.
(૧૦)	ઇલેક્ટ્રોકલ લાઈટ, પંખા, એ.સી.વગેરેના વપરશ માટે સંબંધિત ખાતાધિકારીશ્રીનો અંકુશ રહેશે.
(૧૧)	ચોક સ્થિત કિલ્લાના પ્રિમાઈસીસમાં નિયત કરેલ જગ્યા સિવાય અન્ય જગ્યાએ ચા—નાસ્તો કે કોઈ વસ્તુ તૈયાર કરાવી કે પીરસી શકાશે નહીં પરંતુ કિલ્લામાં કાફેટેરિયા / ટી-રૂમનો ઇજારો અમલમાં હોય તેવા સંજોગોમાં તેનો ઉપયોગ કરી શકશે.
(૧૨)	આર્ટ ગેલેરી કમ એક્ઝિબિશન હોલ / કોન્ફરન્સ રૂમના ઉપયોગ પટે જો કોઈ પણ સંજોગોમાં ભરેલ ડીપોઝીટ્ટી થયેલ ખરેખર ખર્ચની રકમ વધી ગયેલ જણાયતો તેટલી રકમ તાત્કાલીક ડિજિટલ માધ્યમ / રોકડથી બિનયૂક દિન ૧ માં જમા કરાવવાની રહેશે.
(૧૩)	આર્ટ ગેલેરી કમ એક્ઝિબિશન હોલ / કોન્ફરન્સ રૂમના ઉપયોગ પટે જો કોઈ પણ સંજોગોમાં ભરેલ ડીપોઝીટ્ટી થયેલ ખરેખર ખર્ચની રકમ વધી ગયેલ જણાયતો તેટલી રકમ તાત્કાલીક ડિજિટલ માધ્યમ / રોકડથી બિનયૂક દિન ૧ માં જમા કરાવવાની રહેશે.
(૧૪)	ડીપોઝીટ્ટીમાંથી રીફ્ડ કરવાની થતી રકમ કાર્યક્રમ પુરો થયા બાદ સાધારણ રીતે દિન-૩૦ માં પરત કરવામાં આવશે.
(૧૫)	આર્ટ ગેલેરી કમ એક્ઝિબિશન હોલ / કોન્ફરન્સ રૂમના ઉપયોગ દરમ્યાન કોઈ અક્સમાત અગર ગુંઠો થાય તો તેની સઘણી જવાબદારી આર્ટ ગેલેરી કમ એક્ઝિબિશન હોલ / કોન્ફરન્સ રૂમનો ઉપયોગ કરનાર પ્રાયોજકની રહેશે.
(૧૬)	"આર્ટ ગેલેરી કમ એક્ઝિબિશન હોલમાં કોઈપણ પ્રકારના ખાદ્યપદાર્થ, ઠંડાપીણા પાન—મસાલા તેમજ ગુટખા લઈ જવાની સખત મનાઈ છે" જે નોંધ પ્રાયોજકે ટીકીટ આમંત્રણ પત્રિકામાં છપાવવા ફરજીયાત રહેશે. જેનો નમુનો વેચાણ

	કરતા પહેલાં કિલ્લાના સંબંધિત ખાતાધિકારીને રજુ કરવાનો રહેશે. જો ઉપરોક્ત વિગત ટીકીટ/આમંત્રણ પત્રિકામાં છપાવવામાં ન આવશે અને આર્ટ ગેલેરી કમ એક્ઝિબિશન હોલ / કોન્ફરન્સ રૂમમાં ગંદકી જણાયે સફાઈ ચાર્જ પ્રાયોજક પાસેથી વસુલ કરવામાં આવશે.
(૧૭)	(અ) કાર્યક્રમને લગતું જાહેરાતનું એક બેનર (સાઈઝ : ૪' × ૨') કાર્યક્રમની તારીખના ૧(એક) દિવસ અગાઉ વિનામૂલ્યે કિલ્લાના માત્ર બાબુ પરિસરમાં કમ્પાઉન્ડ વોલ ઉપર મુકવા દેવામાં આવશે. જે કાર્યક્રમ પૂર્ણ થયેથી તુરંત જ પરત લઈ જવાનું રહેશે.
	(બ) કાર્યક્રમના સમયે આયોજક દ્વારા જે કાર્યક્રમ હોય તેનું કે સંસ્થાનું એક બેનર (સાઈઝ : ૪' × ૨') આર્ટ ગેલેરી કમ એક્ઝિબિશન હોલ / કોન્ફરન્સ રૂમની બહાર વિનામૂલ્યે મુકી શકાશે. પરંતુ, કિલ્લાના બાબુ પરિસરમાં અન્ય કોઈપણ જગ્યાએ કિલ્લાનાં ખાતાધિકારીની પૂર્વ મંજુરી બાદ માત્ર જાહેરાતોના વ્યાવસાયિક હેતુસર લગાડવામાં આવેલ બેનરો માટે બેનર દીઠ રૂ. ૧૦૦/- પ્રતિ દિન / સેશન તેમજ નિર્ધારિત માપ કરતા મોટી સાઈઝના બેનરો માટે ઉપરોક્ત સાઈઝના ગુણાંક મુજબ ગણતરી કરી, બેનર ચાર્જ આયોજક પાસેથી વસુલ લેવામાં આવશે. તેમ છતાં પૂર્વ મંજુરી બાદ વધુમાં વધુ રૂ. (૪) બેનરો (જે પૈકીના બે વિનામૂલ્યે) મુકી શકાશે.
	(ક) આર્ટ ગેલેરી કમ એક્ઝિબિશન હોલ/ કોન્ફરન્સ રૂમમાં આયોજીત કાર્યક્રમ દરમ્યાન આયોજક દ્વારા એલ.સી.ડી. પ્રોજેક્ટર/વીરીયો પ્રોજેક્ટરના માધ્યમથી સ્કીન ઉપર કાર્યક્રમનું પ્રસારણ, જાહેરાત, ડોક્યુમેન્ટરી ફીલ્મ, પ્રેઝન્ટેશન વિગેરે દર્શાવવામાં આવે તો રૂ. ૫૦૦/- પ્રતિ દિન / સેશન પ્રમાણે ચાર્જ આયોજકની ડીપોઝિટમાંથી વસુલ લેવામાં આવશે.
(૧૮)	ઉક્ત આર્ટ ગેલેરી કમ એક્ઝિબિશન હોલ / કોન્ફરન્સ રૂમ ભાડે રાખનાર આયોજક / વ્યક્તિ/ સંસ્થાએ કિલ્લાના પરિસરમાં જ આવેલ સુરત મહાનગરપાલિકા નિયુક્ત એજન્સી / ઈજારદાર સંચાલિત 'પે એન્ડ પાર્ક' પાર્કિંગ સુવિધાનો ઉપયોગ કરવાનો રહેશે. તેમજ કિલ્લાની પ્રિમાઈસીસમાં અન્ય કોઈ પણ સ્થળે પાર્કિંગ કરાવી / કરી શકશે નહી તેમજ જો પાર્કિંગનો ઈજારો આપવામાં આવેલ ન હોય ત્યારે આયોજકે પોતે સ્વયં સેવક રાખી કોઈપણ પ્રકારે અડચણ ઉભી ન થાય તે પ્રકારે ફી પાર્કિંગ કરાવવાનું રહેશે.
(૧૯)	કિલ્લામાં ઈલેક્ટ્રીક પાવરના વિક્ષેપ દરમ્યાન જો જનરેટરનો ઉપયોગ કરવામાં આવે તો પ્રતિ યુનિટ નિયત કરેલ ચાર્જ વસુલ કરવામાં આવશે.
(૨૦)	આર્ટ ગેલેરી કમ એક્ઝિબિશન હોલ / કોન્ફરન્સ રૂમના ઉપરોક્ત તમામ નિયમોના અર્થધટન માટે અને તેમાંથી ઉપસ્થિત થતી કોઈપણ બાબતમાં મ્યુનિ. કમિશનરશ્રી કે તેમના અધિકૃત અધિકારીનો નિષ્ણય આખરી અને બંધનકર્તા ગણાશે. જેના બંગ બદલ મ્યુનિ.કમિશનરશ્રી કે તેના અધિકૃત અધિકારીશ્રી દંડ કરી શકશે.
(૨૧)	આર્ટ ગેલેરી કમ એક્ઝિબિશન હોલ / કોન્ફરન્સ રૂમમાં કોઈ વિશેષ હેતુ માટે મિટિંગ હોઈ તથા કિલ્લાના ખુલ્લા વિસ્તાર નો ઉપયોગ કરવા અંગે પ્રાયોજકે તે અંગે અગાઉથી જાણ કરી પરવાનગી મેળવવાની રહેશે તથા જે તે વિસ્તારના વપરાશ પેટે વસુલવા જોગ વધારાના ભાડાના દર તેમજ ડિપોઝિટની રકમ નક્કી કરવાની સત્તા મ્યુ.કમિશનરશ્રીને રહેશે.

:: આર્ટ ગેલેરી કમ એક્ઝિબિશન હોલના વપરાશના દરો ::

ક્રમ	વિગત	આર્ટ ગેલેરી કમ એક્ઝિબિશન હોલ		રીમાર્ક
૧.	સમય	સવારે ૧૦:૦૦ થી સાંજે ૦૮:૦૦ કલાક સુધી પ્રતિદિન		-----
૨.	વપરાશનો હેતુ	શૈક્ષણિક કાર્યક્રમો તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ જેમ કે, પ્રદર્શન, વ્યાખ્યાન, સંવાદ, પરિસંવાદ, સેમિનાર, પ્રવચન, પ્રેઝન્ટેશન, વર્કશૉપ, સાહિત્ય ગોષ્ઠી, પુસ્તક વિમોચન, વિવેચન વિગેરે		-----
૩.	ઉપલબ્ધ સુવિધાઓ	સંપૂર્ણ વાતાનુકૂલિત		અન્ય સુવિધાઓની વ્યવસ્થા આયોજકે સ્વભર્યે કરવાની રહેશે
૪.	ક્ષમતા	૨૬૬ ચો.મી. (અંદાજીત વિસ્તાર)		-----
મંગળવાર થી રવિવાર				
		ફક્ત કલા પ્રદર્શન માટે વેચાણ સિવાય	પ્રદર્શન સહ વેચાણ માટે	
૫.	ભાડાની રકમ (રૂ.)	૨,૪૭૧/- (પ્રતિ દિન)	૭,૨૮૭/- (પ્રતિ દિન)	પ્રતિ દિન થનાર કુલ ખર્ચની રકમ પેટે
	જે પેકી ડિપોઝીટની રકમ (રૂ.)	૮,૧૪૫/- (પ્રતિ દિન)	૧૫,૮૬૦/- (પ્રતિ દિન)	ભાડા સિવાયના અન્ય ખર્ચની વસુલાત પેટે
	અરજદાર દ્વારા જમા કરાવવા જોગ કુલ રકમ (રૂ.)	૧૧,૫૭૬/- (પ્રતિ દિન)	૨૭,૧૫૭/- (પ્રતિ દિન)	-----
<p>નોંધ:-—સોમવાર તથા જાહેર રજાના દિવસોએ આર્ટ ગેલેરી કમ એક્ઝિબિશન હોલનો વપરાશ કરવા ઈચ્છતી વ્યક્તિ/સંસ્થા વિગેરે નિયત રકમ કરતા ૨૫% વધુ ડિપોઝીટ તથા ભાડાની રકમ બિનયૂક ભરી વપરાશ કરી શકશે.</p>				
(ક)	એ.સી. ચાર્જ (રૂ.)	મંગળવાર થી રવિવાર		
		૭૩૦/- (પ્રતિ કલાક)	૭૩૦/- (પ્રતિ કલાક)	-----
		સોમવાર તથા જાહેર રજાના દિવસો		
(ખ)	વિજણી ખર્ચ	૮૭૨/- (પ્રતિ કલાક)	૮૭૨/- (પ્રતિ કલાક)	-----
		વિજ પુરવઠો પૂરો પાડતી સંસ્થાના જે-તે સમયના પ્રવર્તમાન દરો મુજબ		
		૧૦/- રૂ પ્રતિ સ્ક્વેર ફૂટ પ્રમાણે.		
(ગ)	બેનર ચાર્જ (રૂ.)	૧૦/-		
		૧૦/-		
(ધ)	સ્ટોલ ચાર્જ (રૂ.)	૧૦૦/-		
		૧૦૦/-		
(ય)	સફાઈ ખર્ચ	૨૫૦/- ઉપરાંત કાર્યક્રમ પૂર્ણ થયા બાદની પરિસ્થિતિને આધિન		
		કાર્યક્રમ પૂર્ણ થયા બાદ આયોજક દ્વારા વેસ્ટેજનો નિકાલ નહીં કરવાના કિસ્સામાં સફાઈ ખર્ચ વસુલ લેવામાં આવશે.		
(ઇ)	નુકશાની	કાર્યક્રમ પૂર્ણ થયા બાદની પરિસ્થિતિને આધિન		
		જો કોઈ કિસ્સામાં મિલકતને નુકશાન થયેલ હોવાનું માલુમ પડશે તો મરામત ખર્ચ વસુલ લેવામાં આવશે.		

(૪)	કેન્દ્ર/રાજ્ય સરકાર તેમજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા વસુલ લેવા જોગ લાગત કર વેરા વિગેરે	જે-તે સમયે લાગુ કર વેરા	હાલમાં ખર્ચની કુલ રકમના ૧૮%ના દરે જી.એસ.ટી. વસુલ લેવામાં આવે છે.
૬.	ટીકીટોના વેચાણ/ બુકીગ માટે ફક્ત ટેબલ વ્યવસ્થા અંગે નંગ દીઠ ફક્ત ટેબલ વ્યવસ્થાનો ઉપયોગ કરવા માટેનો એક દિવસ દીઠ દર	રૂ.૩૦૦-૦૦	
	કાર્યક્રમની તારીખ બદલવાનો ચાર્જ (આર્ટ ગેલેરી કમ એક્ઝિબિશન હોલનો ઉપયોગ કરવા માટે જે તારીખનું રીજર્વેશન મેળવવામાં આવ્યું હોય તે તારીખ/કાર્યક્રમનો પ્રકાર સામાન્ય સંજોગોમાં બદલી આપવામાં આવશે નહીં પરંતુ કોઈ ખાસ સંજોગોમાં/એકથી વધુ દિવસના કરાયેલ એક જ પ્રાયોજકના કિસ્સામાં તારીખ/કાર્યક્રમનો પ્રકાર બદલી આપવાની સત્તા વિભાગીય વડાશીની રહેશે)	ભાડાની રકમના ૨૫% મુજબ	
	કાર્યક્રમનો પ્રકાર અથવા નામમાં ફેરફાર કરવાનોનો ચાર્જ	ભાડાની રકમના ૨૫% મુજબ	
	પૂર્વ તૈયારી (અગાઉનાં દિવસે ખાલી હશે તો)/ ખાલી કરવા માટે (પાઇણો દિવસ ખાલી હશે તો)	ભાડાની રકમના ૨૫% મુજબ	
૭.	સુ.મ.પા.ની હદમા એ.સી. ચાર્જીસ : એ.સી. પ્લાન્ટના પ્રવર્તમાન વીજળીના દરથી ગણતાં પ્રતિ કલાક દીઠ રૂ.૭૩૦/- મંગળવાર થી રવિવાર માટે તથા પ્રતિ કલાક દીઠ રૂ.૮૭૨/-સોમવાર તથા જાહેર રજાના દિવસો માટે જે અલગથી વસુલ લેવામાં આવશે.	સુ.મ.પા.ની હદની બહાર માટે	
	એ.સી. ચાર્જીસ : એ.સી. પ્લાન્ટના પ્રવર્તમાન વીજળીના દરથી ગણતાં પ્રતિ કલાક દીઠ રૂ.૮૫૨/- મંગળવાર થી રવિવાર માટે તથા પ્રતિ કલાક દીઠ રૂ.૧૦૮૪/-સોમવાર તથા જાહેર રજાના દિવસો માટે જે અલગથી વસુલ લેવામાં આવશે.		
૮.	જનરલ લાઈટીંગ માટે જે ખરેખર વીજળી બળતણ થાય તે મુજબ રૂ.૧૨/- પ્રતિ યુનિટ લેખેની રકમ ભરેલી ડીપોઝીટમાંથી આપવાની રહેશે. વખતોવખત વીજ કંપની તરફથી વીજ બળતણ ચાર્જમાં ફેરફાર થાય તે મુજબ ચાર્જ આપવાનો રહેશે. તેવી જ રીતે જો વીજળી સપ્લાય બંધ થતા જનરેટરનો વપરાશ કરવામાં આવે તો રૂ.૨૫/- પ્રતિ યુનિટ લેખેની રકમ ભરેલી ડીપોઝીટમાંથી આપવાની રહેશે.		
૯.	કાર્યક્રમમાં જો સ્ટોલ બનાવવાનાં હોય તો તેના માટે પ્રતિ સ્ટોલ દીઠ (10×10 કુટ સાઈઝ) માટે રૂ.૧૦૦/- મુજબ કુલ ચૂકવવા પાત્ર રકમ એડવાન્સમાં ડિપોઝીટ પેટે અલગથી વધારાની ચૂકવવાની રહેશે.		

:: કોન્ફરન્સ રૂમના વપરાશના દરો ::

ક્રમ	વિગત	કોન્ફરન્સ રૂમ	રીમાર્ક
૧.	સમય	સવારે ૦૮:૦૦ થી બપોરે ૧૨.૦૦ કલાક સુધી (૩ કલાક) બપોરે ૦૧:૦૦ થી બપોરે ૦૪.૦૦ કલાક સુધી (૩ કલાક) સાંજે ૦૫:૦૦ થી રાત્રે ૦૮.૦૦ કલાક સુધી (૩ કલાક)	-----
૨.	વપરાશનો હેતુ	શૈક્ષણિક કાર્યક્રમો/ સાહિત્યિક/ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ જેમ કે, સંવાદ, વર્કશૉપ, મીટિંગ, જીવચર્ચા, પ્રેઝન્ટેશન, સાહિત્ય ગોષ્ઠી, પુસ્તક વિવેચન વિગેરે	-----
૩.	ઉપલબ્ધ સુવિધાઓ	સંપૂર્ણ વાતાનુકૂલિત, કોન્ફરન્સ સીસ્ટમ (માઈક તથા સ્પીકર), કોન્ફરન્સ ટેબલ	અન્ય સુવિધાઓની વ્યવસ્થા આયોજકે સ્વભર્યે કરવાની રહેશે
૪.	ક્ષમતા	૪૦ – ૫૦ (અંદાજીત બેઠક ક્ષમતા)	કોન્ફરન્સ રૂમની અંદર વધારાની ખૂરશીઓ અધિકારીશ્રીની સુચનાને આધિન મુકી શકશે
૫.	ભાડાની રકમ (રૂ.)	મંગળવાર થી રવિવાર	
		૧,૮૨૪/-	સેશન દીઠ થનાર કુલ ખર્ચની રકમ પેટે
	જે પૈકી ડિપોઝિટની રકમ (રૂ.)	૬,૭૫૩/-	ભાડા સિવાયના અન્ય ખર્ચની વસુલાત પેટે
	અરજદાર ધ્વારા જમા કરાવવા જોગ કુલ રકમ (રૂ.)	૧૧,૫૭૭/-	-----
નોંધ:- સોમવાર તથા જાહેર રજાના દિવસોએ કોન્ફરન્સ રૂમનો વપરાશ કરવા ઈચ્છતી વ્યક્તિ/સંસ્થા વિગેરેએ નિયત રકમ કરતા રૂપે ૨૫% વધુ ડિપોઝિટ તથા ભાડાની રકમ સાથે જમા કરવાજોગ કુલ રકમ બિનચૂક ભરી બાદ જ વપરાશ કરી શકશે.			
(ક)	વધારાના સમયનું ભાડુ (રૂ.)	૨૦૦/- (૩૦ મીનીટ માટે)	-----
(ખ)	એ.સી. ચાર્જ (રૂ.)	મંગળવાર થી રવિવાર	
		૭૩૦/- (પ્રતિ કલાક)	-----
		સોમવાર તથા જાહેર રજાના દિવસો	
(ગ)	પ્રોજેક્ટર તથા સ્ક્રીન ચાર્જ (રૂ.)	૧૦૦૦/-	સેશન દીઠ
(ઘ)	વિજઞી ખર્ચ	વિજ પુરવઠો પૂરો પાડતી સંસ્થાના જે-તે સમયના પ્રવર્તમાન દરો મુજબ	
(ચ)	બેનર ચાર્જ (રૂ.)	૧૦/-રૂ પ્રતિ સ્ક્વેર ફૂટ પ્રમાણે.	સેશન દીઠ બે થી વધુ બેનરો લગાડવાના કિસ્સામાં
(ઝ)	સફાઈ ખર્ચ	૨૫૦/- ઉપરાંત કાર્યક્રમ પૂર્ણ થયા બાદની પરિસ્થિતિને આધિન	કાર્યક્રમ પૂર્ણ થયા બાદ આયોજક દ્વારા વેસ્ટેજનો નિકાલ નહીં કરવાના કિસ્સામાં સફાઈ ખર્ચ વસુલ લેવામાં આવશે
(ઝ)	નુકશાની	કાર્યક્રમ પૂર્ણ થયા બાદની પરિસ્થિતિને આધિન	જો કોઈ કિસ્સામાં મિલકતને નુકશાન થયેલ હોવાનું માલુમ પડશે તો મરામત ખર્ચ

			વસુલ લેવામાં આવશે
(ઝ)	કેન્દ્ર/રાજ્ય સરકાર તેમજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા વસુલ લેવા જોગ લાગત કર વેરા વિગેરે	જે-તે સમયે લાગુ કર વેરા	હાલમાં ખર્ચની કુલ રકમના ૧૮%ના દરે જી.એસ.ટી. વસુલ લેવામાં આવે છે
૬.	<p>કાર્યક્રમની તારીખ અથવા સમયખંડ બદલવાનો ચાર્જ</p> <p>(કોન્ફરન્સ રૂમનો ઉપયોગ કરવા માટે જે તારીખનું રીજર્વેશન મેળવવામાં આવ્યું હોય તે તારીખ/સેશન/કાર્યક્રમનો પ્રકાર સામાન્ય સંજોગોમાં બદલી આપવામાં આવશે નહીં પરંતુ કોઈ ખાસ સંજોગોમાં/એકજ દિવસ માટે કરાયેલ એકજ પ્રાયોજક દ્વારા કરાયેલ બે કે તેથી વધુ સેશનના ડિસ્સામાં તારીખ/સેશન/કાર્યક્રમનો પ્રકાર બદલી આપવાની સત્તા વિભાગીય વડાશીની રહેશે)</p>		ભાડાની રકમના ૨૫% મુજબ
	<p>કાર્યક્રમનો પ્રકાર અથવા નામમાં ફેરફાર કરવાનોનો ચાર્જ</p> <p>પૂર્વ તૈયારી (અગાઉનું સેશન ખાલી હશે તો) / ખાલી કરવા માટે (પાછળનું સેશન ખાલી હશે તો)</p> <p>(કોન્ફરન્સ રૂમ માટે)</p>		ભાડાની રકમના ૨૫% મુજબ
૭.	<p>કાર્યક્રમનો પ્રકાર અથવા નામમાં ફેરફાર કરવાનોનો ચાર્જ</p> <p>પૂર્વ તૈયારી (અગાઉનું સેશન ખાલી હશે તો) / ખાલી કરવા માટે (પાછળનું સેશન ખાલી હશે તો)</p> <p>(કોન્ફરન્સ રૂમ માટે)</p>	<p>એક કલાકનો દર બે કલાકનો દર સેશનનો દર</p>	<p>ભાડાની રકમના ટકાવારી મુજબ ૫% ૧૫% ૨૫%</p>
૮.	<p>સુ.મ.પા.ની હણમા</p> <p>એ.સી. ચાર્જીસ : એ.સી. પ્લાન્ટના પ્રવર્તમાન વીજળીના દરથી ગણતાં પ્રતિ કલાક દીઠ રૂ.૭૩૦/- મંગળવાર થી રવિવાર માટે તથા પ્રતિ કલાક દીઠ રૂ.૮૭૨/-સોમવાર તથા જાહેર રજાના દિવસો માટે જે અલગથી વસુલ લેવામાં આવશે.</p>		
	<p>સુ.મ.પા.ની હણની બહાર માટે</p> <p>એ.સી. ચાર્જીસ : એ.સી. પ્લાન્ટના પ્રવર્તમાન વીજળીના દરથી ગણતાં પ્રતિ કલાક દીઠ રૂ.૮૫૨/- મંગળવાર થી રવિવાર માટે તથા પ્રતિ કલાક દીઠ રૂ.૧૦૮૪/-સોમવાર તથા જાહેર રજાના દિવસો માટે જે અલગથી વસુલ લેવામાં આવશે.</p>		
૯.	જનરલ લાઇટીંગ માટે જે ખરેખર વીજળી બળતણ થાય તે મુજબ રૂ.૧૨/- પ્રતિ યુનિટ લેખેની રકમ ભરેલી ડિપોઝીટમાંથી આપવાની રહેશે. વખતોવખત વીજ કંપની તરફથી વીજ બળતણ ચાર્જમાં ફેરફાર થાય તે મુજબ ચાર્જ આપવાનો રહેશે. તેવી જ રીતે જો વીજળી સપ્લાય બંધ થતા જનરેટરનો વપરાશ કરવામાં આવે તો રૂ.૨૫/- પ્રતિ યુનિટ લેખેની રકમ ભરેલી ડિપોઝીટમાંથી આપવાની રહેશે.		
૧૦.	કોન્ફરન્સ રૂમમાં ચા-કોફી તેમજ હળવો નાસ્નો (માત્ર શાકાહારી) પીરસી શકાશે અને આ માટે કિલ્લાના ખાતાધિકારી જે રકમ નક્કી કરે તે પ્રમાણે અલગથી ભરેલ ડિપોઝીટમાંથી વસુલવામાં આવશે. તમામ ખાદ્ય પદાર્થ તથા પીણા તૈયાર લાવીને પીરસવાના રહેશે, કિલ્લામાં કોઈ પણ સ્થળે ખાદ્ય પદાર્થ તેમજ પીણા બનાવવા દેવામાં આવશે નહીં. આ દરમ્યાન ગંઢકી થાય તો કાર્યક્રમ કરનાર વ્યક્તિ / સંસ્થા દ્વારા સાફ સફાઈ કરવાની રહેશે અન્યથા કિલ્લાના ખાતાધિકારી દ્વારા નક્કી કરવામાં આવેલ પેનલ્ટી ભરેલ ડિપોઝીટમાંથી વસુલવામાં આવશે.		

નિયત ભાડા સાથે વિનામુલ્યે આપવા જોગ ઇન્સ્ટ્રેન્ટ ::

<u>કિલ્લા ખાતે આવેલ આર્ટ ગેલેરી કમ એક્ઝિબિશન હોલ / કોન્ફરન્સ રૂમની વિગતો</u>	
૪૦ બેઠક ધરાવતું કોન્ફરન્સ રૂમ તથા આર્ટ ગેલેરી કમ એક્ઝિબિશન હોલ સંપૂર્ણ રીતે વાતાનુકૂલ છે.	
માઈક (કોન્ફરન્સ રૂમ)
પોડીયમ (કોન્ફરન્સ રૂમ)	૧
"S" હૂક (આર્ટ ગેલેરી કમ એક્ઝિબિશન હોલ)	૨૦
નાના પેડેસ્ટલ (આર્ટ ગેલેરી કમ એક્ઝિબિશન હોલ)	૫
મોટા પેડેસ્ટલ (આર્ટ ગેલેરી કમ એક્ઝિબિશન હોલ)	૫
ઇઝલ સ્ટેન્ડ (આર્ટ ગેલેરી કમ એક્ઝિબિશન હોલ)	૫

ઉક્ત દર્શાવેલ લાઈટ/સાધનો સિવાય વધારાના લાઈટ/સાધનો માટે નીચે મુજબનું ભાડું ડિપોઝિટમાંથી વસુલ લેવામાં આવશે.

કર્નિચરના ભાડાના દર

અ. નં.	વસ્તુ	ભાવ રૂ. (પ્રતી નંગ)
૧	ખુરશી ગાદીવાળી	૨૫
૨	લાકડાનું ટેબલ	૧૦૦
૩	પ્લાસ્ટિક ખુરશી હાથાવાળી	૧૫
૪	કોર્લેસ માઈક	૨૦૦
૫	પ્રોજેક્ટર + સ્ક્રીન	૧૦૦૦
૬	ફોન સ્ક્રીન	૫૦૦
૭	લાકડાનું નાનું ટેબલ	૫૦
૮	લાકડાના બાકડા	૫૦
૯	રંગોળીના બોર્ડ	૧૦૦
૧૦	ઓગલ	૨૫
૧૧	"S" હૂક	૦૫
૧૨	નાના પેડેસ્ટલ	૫૦
૧૩	મોટા પેડેસ્ટલ	૭૫
૧૪	ઇઝલ સ્ટેન્ડ	૧૦૦
૧૫	પોડીયમ	૧૦૦

:: કિલ્લા ખાતે વ્યવસાયિક / પ્રોફેશનલ ફોટોગ્રાફી તેમજ વિડિયોગ્રાફી કરવાના દર તથા નિયમો ::

સમય :	સવારે ૦૮:૦૦ કલાક થી રાત્રે ૦૮:૦૦ કલાક સુધી
ફોટોગ્રાફીનો પ્રકાર –	પોટફોલીયો શુટ, પ્રિવેટીગ તથા તેવા પ્રકારની ફોટોગ્રાફી, સ્પેશીયલ ઓકેશન ફોટોશૂટ, ફોટોગ્રાફી કોમ્પીટીશન, જાહેરાત માટેની ફોટોગ્રાફી વિગેરે..
વ્યવસાયિક / પ્રોફેશનલ ફોટોગ્રાફીનો દર :	રૂ. ૩૧,૬૦૭/- સંપૂર્ણ દિવસ માટે
	અથવા રૂ. ૩,૧૬૧/- પ્રતિ કલાક લેખે
વિડિયોગ્રાફી પ્રકાર –	પોટફોલીયો શુટ, પ્રિવેટીગ તથા તેવા પ્રકારની વિડિયોગ્રાફી, સ્પેશીયલ ઓકેશન વિડિયોશૂટ, વિડિયોગ્રાફી કોમ્પીટીશન, જાહેરાત માટેની વિડિયોગ્રાફી, ડોક્યુમેન્ટરી મુવી મેક્રીગ, ફિલ્મ /સીરીયલ/ વેબ સીરીઝ માટેની વિડિયોગ્રાફી વિગેરે..
વ્યવસાયિક / પ્રોફેશનલ વિડિયોગ્રાફીનો દર :	રૂ. ૬૩,૮૧૫/- સંપૂર્ણ દિવસ માટે
	અથવા રૂ. ૬,૩૮૧/- પ્રતિ કલાક લેખે

નોંધ :

૧.	વ્યવસાયિક / પ્રોફેશનલ ફોટોગ્રાફી તેમજ વિડિયોગ્રાફી માટે કિલ્લામાં આવેલ ગેલેરીઓમાં ઉપલબ્ધ કોઈપણ ફર્નિચર તેમજ તેના જેવી વ્યવસ્થાનો ઉપયોગ કલાકારો કે શુટીગમાં સામેલ કોઈપણ વ્યક્તિની કરી શકશે.
૨.	સોમવાર તેમજ જાહેર તહેવારના દિવસો કે જે દરમિયાન કિલ્લો જાહેર જનતા માટે બંધ હોય ત્યારે જો વ્યવસાયિક / પ્રોફેશનલ ફોટોગ્રાફી તેમજ વિડિયોગ્રાફી કરવાના દરમાં ૨૫% લેખે વધારો વસુલવામાં આવશે.
૩.	વ્યવસાયિક / પ્રોફેશનલ ફોટોગ્રાફી તેમજ વિડિયોગ્રાફી જો જાહેર જનતાની મુલાકાતના સમયગાળા દરમિયાન કરવામાં આવે તો જાહેર જનતાની મુલાકાતમાં કોઈપણ પ્રકારનો વિક્ષેપ ના પડે તેની પ્રાયોજકોએ કાળજી લેવાની રહેશે.
૪.	વ્યવસાયિક / પ્રોફેશનલ ફોટોગ્રાફી તેમજ વિડિયોગ્રાફી દરમિયાન કિલ્લાની સંપત્તિ તેમજ હાજર જાહેર જનતાને નુકશાન પહોંચે તેવા પદાર્થો તેમજ સામગ્રી જેવા કે કોઈપણ પ્રકારના જવલનશીલ કે ઘડાકીયા પદાર્થો, કોઈપણ પ્રકારના રંગો, હથિયારો, માદક પદાર્થો, ધૂમપાન વિગેરેનો ઉપયોગ પ્રતિબંધિત રહેશે.
૫.	વ્યવસાયિક / પ્રોફેશનલ ફોટોગ્રાફી તેમજ વિડિયોગ્રાફી ઐતિહાસિક કિલ્લાની ગરીમા જાળવી રાખે તેવા પ્રકારની હોવી જોઈએ તથા કોઈપણ પ્રકારના અભદ્ર ભાષા તેમજ અભદ્ર પરિવેષનો ઉપયોગ પ્રતિબંધિત રહેશે.
૬.	સાયિક / પ્રોફેશનલ ફોટોગ્રાફી તેમજ વિડિયોગ્રાફી માટે શ્રીન રૂમ/ ચેઈન્જ રૂમ/ મેઈક-અપ રૂમ ઈન્દ્રિયાદીની સગવડ પ્રાયોજકે કિલ્લાના અધિકૃત અધિકારીની પૂર્વમંજુરી મેળવી સ્વખર્ય કરવાની રહેશે.
૮.	પ્રાયોજકે પોતાના વાહનો નિર્ધારીત જગ્યાએ નિર્ધારીત ચુકવણુ કર્યા બાદ પાર્કિંગ કરવાની રહેશે.
૯.	પ્રાયોજકે સુરતમહાનગરપાલિકાના સિક્યુરિટી સ્ટાફ કે ફરજ પરનાં સ્ટાફ સાથે ગેરવર્તણુક કે જઘડો કરવો નહીં.
૧૦.	વ્યવસાયિક / પ્રોફેશનલ ફોટોગ્રાફી તેમજ વિડિયોગ્રાફીમાં વપરાશમાં આવનાર સાધનોના વીજ વપરાશ માટે કિલ્લા ખાતે જો પૂરતી સગવડ ઉપલબ્ધ ન હોય તેવા કિસ્સામાં વીજ વપરાશની સગવડ પ્રાયોજકે સ્વખર્ય ઉભી કરવાની રહેશે.
૧૧.	વ્યવસાયિક / પ્રોફેશનલ ફોટોગ્રાફી તેમજ વિડિયોગ્રાફીમાં વપરાશમાં આવનાર તેમજ પોતાની સાથે લાવેલ તમામ સાધનોની જવાબદારી પ્રાયોજકની રહેશે.

૧૨.	કિલ્લા ખાતે મુલાકાત માટે ખુલ્લી મુકેલ બિલ્ડીગ સિવાયની અન્ય કોઈપણ જગ્યા ઉપર વ્યવસાયિક / પ્રોફેશનલ ફોટોગ્રાફી તેમજ વિડિયોગ્રાફી પ્રતિબંધીત રહેશે.
૧૩.	વ્યવસાયિક / પ્રોફેશનલ ફોટોગ્રાફી તેમજ વિડિયોગ્રાફી કરતા પૂર્વે શુટીગમાં ભાગ લેનાર તમામ વ્યક્તિત્વોના નામ તથા સંખ્યા બિનયુક કિલ્લાના અધિકૃત અધિકારીને જણાવવાના રહેશે. આ સિવાયની કોઈપણ વ્યક્તિને શુટીગ માટે પ્રવેશ આપવામાં આવશે નહિ.
૧૪.	મહાનગરપાલિકાની મિલકતને કે સાધનોને કોઈપણ પ્રકારનું નુકશાન થાય થાય તો મ્યુ.કમિશનરશ્રી અથવા અધિકૃત અધિકારીશ્રી તેની કરેલ આકારણીની રકમ એટલે થયેલ નુકશાનની રકમ પ્રાયોજક પાસેથી વસુલ કરી શકશે.
૧૫.	કિલ્લાની મુલાકાત દરમ્યાન આકસ્મિક સંજોગોમાં દુર્ઘટના સર્જાયને તેના થકી કોઈપણ વ્યક્તિને નુકશાન થાય તો તેની જવાબદારી પ્રાયોજકની રહેશે.
૧૬.	કુદરતી કે આકસ્મિક સંજોગોમાં વિકટ પરિસ્થિતિ સર્જાય તો કિલ્લામાં વ્યવસાયિક / પ્રોફેશનલ ફોટોગ્રાફી તેમજ વિડિયોગ્રાફી બંધ કરવાનો મ્યુ.કમિશનરશ્રી કે તેના અધિકૃત અધિકારીશ્રીનો નિર્ણય આખરી અને બંધનકર્તા ગણાશે.
૧૭.	કિલ્લામાં વ્યવસાયિક / પ્રોફેશનલ ફોટોગ્રાફી તેમજ વિડિયોગ્રાફી કરવા માટે જે તારીખનું રીજર્વેશન મેળવવામાં આવ્યું હોય તે તારીખ/સમય સામાન્ય સંજોગોમાં બદલી આપવામાં આવશે નહી પરંતુ કોઈ ખાસ સંજોગોમાં તારીખ/સમય બદલી આપવાની સત્તા વિભાગીય વડાશ્રીની રહેશે જે માટે અરજદારે વધારાની ફી તરીકે રૂ. ૫૦૦/- ચુકવવાના રહેશે અને તે માટે અગાઉથી અરજી કરી તેમજ વધારાની ફી સહીત કચેરીના સમય દરમ્યાન અરજી તથા ફી જમા કરાવવાની રહેશે. કોઈપણ કિસ્સામાં તારીખ/સમય બદલી આપવું કે નહી તે અંગેનો નિર્ણય વિભાગીય વડાશ્રીનો આખરી અને અરજદારને બધનકર્તા રહેશે.
૧૮.	કિલ્લા ખાતે મુલાકાત માટે ખુલ્લી મુકેલ બિલ્ડીગમાં તથા અન્ય કોઈપણ જગ્યા ઉપર લગાડેલ કલાકૃતિ / ફર્નિચર / પેનલોની વ્યવસાયિક / પ્રોફેશનલ ફોટોગ્રાફી તેમજ વિડિયોગ્રાફી પ્રતિબંધીત રહેશે.
૧૯.	કુદરતી કે આકસ્મિક સંજોગોમાં વિકટ પરિસ્થિતિ સર્જાય તે સિવાયના માનસજીત નુકશાન થાય ત્યારે તે નકકી કરવાની તથા તેના વસુલાત લેવા માટે મા.કમિશનરશ્રી અધિકૃત રહેશે.
૨૦.	કિલ્લામાં વ્યવસાયિક / પ્રોફેશનલ ફોટોગ્રાફી તેમજ વિડિયોગ્રાફી કરવા માટે કિલ્લાના સંકુલમાં આવેલ વિવદ્ધ ગેલેરી અને/અથવા ઉપલબ્ધ ખુલ્લા વિસ્તાર નો ઉપયોગ કરવા માટે જે કોઈ લાગુ પડતા તેમજ ફોટોગ્રાફી તથા વિડિયોગ્રાફીમાં ઉપયોગમાં લેનાર દ્રશ્ય—શાય જેવી કન્ટેન્ટ ઈત્યારી ને લગતા મનોરંજન લાઈસન્સ, કોપીરાઇટ અને ટ્રેડ માર્ક, રોયલ્ટી તથા અન્ય લાગુ તમામ કાયદાઓ તથા નિયમોનું ચુસ્ત પણે પાલન કરવાનું રહેશે તથા જેના ભંગ અંગેની સંપૂર્ણ જવાબદારી પ્રાયોજકોની રહેશે.
૨૧.	કિલ્લામાં વ્યવસાયિક / પ્રોફેશનલ ફોટોગ્રાફી તેમજ વિડિયોગ્રાફી કરવા માટે કિલ્લાના સંકુલમાં આવેલ વિવદ્ધ ગેલેરી અને / અથવા ઉપલબ્ધ ખુલ્લા વિસ્તાર નો ઉપયોગ કરવા માટે જે કોઈ લાગુ પડતા તેમજ ફોટોગ્રાફી તથા વિડિયોગ્રાફીમાં ઉપયોગમાં લેનાર દ્રશ્ય—શાય જેવી કન્ટેન્ટ ઈત્યારી ને લગતા મનોરંજન લાઈસન્સ, કોપીરાઇટ અને ટ્રેડ માર્ક, રોયલ્ટી તથા અન્ય લાગુ તમામ કાયદાઓ તથા નિયમોનું ચુસ્ત પણે પાલન કરવાનું રહેશે તથા જેના ભંગ અંગેની સંપૂર્ણ જવાબદારી પ્રાયોજકોની રહેશે.
૨૨.	કિલ્લામાં વ્યવસાયિક / પ્રોફેશનલ ફોટોગ્રાફી તેમજ વિડિયોગ્રાફીમાં ઉપયોગમાં લેવામાં આવનાર ડ્રોન કેમેરા તેમજ તેના જેવા અન્ય સાધનોના વપરાશ માટે પ્રવર્તમાન કાયદાકીય જગવાઈ અનુસાર N.O.C. / મંજુરી મેળવી તેમજ કિલ્લાના અધિકૃત અધિકારી સમક્ષ રજુ કર્યા બાદ વપરાશ કરવાનો રહેશે. આમ કરવામાં ચૂક થાય તો તે અંગેના કાયદાકીય ભંગની તમામ જવાબદારી પ્રાયોજકની રહેશે.

કલમ – ૪ (૧) (ખ) (૪)

પોતાના કાર્યો બજાવવા માટે પોતે નક્કી કરેલા ધોરણો

સંસ્થાના કામના નિકાલ કરવાના ધોરણોની વિગતો સુરત મહાનગરપાલિકાની વેબસાઈટ
www.suratmunicipal.gov.in પર મુકવામાં આવેલ છે.

કલમ – ૪ (૧) (ખ) (૫)

કાર્યો બજાવવા માટે અથવા નિયંત્રણ હેઠળના કર્મચારીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા નિયમો,
વિનિયમો, સુચનાઓ, નિયમ સંગ્રહો અને રેકર્ડ:

કાર્ય કરવાના નિયમો, સુચના, મેન્યુઅલ અને રેકર્ડની વિગતો સુરત મહાનગરપાલિકાની
વેબસાઈટ
www.suratmunicipal.gov.in પર મુકવામાં આવેલ છે.

કલમ – ૪ (૧) (૫) (૭)

નીતી ઘડતરના અથવા તેના અમલીકરણના સંબંધમાં જનતાના સભ્યો સાથે વિચાર
વિનિમય માટે અથવા તેમના દ્વારા રજૂઆત માટેની વિદ્યમાન કોઈ વ્યવસ્થાની વિગતો

સુરત મહાનગરપાલિકા જાહેર સત્તા મંડળ સાથે સંયુક્ત છે.

કલમ – ૪ (૧) (ખ) (૮)

સલાહના હેતુઓ માટે બે અથવા તેથી વધુ વ્યક્તિત્વોના બનેલા બોર્ડ કાઉન્સીલો.
સમિતિઓ

સુરત મહાનગરપાલિકા જાહેર સત્તા મંડળ સાથે સંયુક્ત છે.

કલમ – ૪ (૧) (ખ) (૮)

પ્રકરણ – ૧૦

અધિકારીશ્રી / કર્મચારીશ્રી ઓની માહિતી પુસ્તકા (ડિરેક્ટરી)

બીસીએન્ટી વાઈજ અધિકારી અને કર્મચારીઓની માહિતી www.suratmunicipal.gov.in પર સંયુક્ત રીતે મુકવામાં આવેલ છે. તથા અત્રેના ખાતાના કર્મચારીઓનો મહેકમ દફ્તર તથા પગાર રજીસ્ટરની નકલ ખાતામાં ઉપલબ્ધ છે.

કલમ – ૪ (૧) (ખ) (૧૦)

દરેક અધિકારીઓ અને કર્મચારીઓને મળતા માસિક મહેનતાણા

બીસીએન્ટી વાઈડ અધિકારીઓની અને કર્મચારીઓની માહિતી

www.suratmunicipal.gov.in પર સંયુક્ત રીતે મુકવામાં આવેલ છે. તથા અત્રેના ખાતાના કર્મચારીઓના મહેકમ તથા પગાર રજીસ્ટરની નકલ ખાતામાં ઉપલબ્ધ છે.

કલમ – ૪ (૧) (ખ) (૧૧)
તમામ યોજનાઓ, સુચિત, ખર્ચ, ચુકવેલ નાણાં પરના અહેવાલોની વિગતો દશાવતં
અંદાજપત્ર

બીસીએનટી વાઈડ વિભાગની અંદાજપત્રની માહિતી www.suratmunicipal.gov.in સંયુક્ત રીતે મુકવામાં આવેલ છે.

કલમ – ૪ (૧) (ખ) (૧૩)
ઇટાટો, પરવાનગીઓ અથવા અધિકૃતિઓ મેળવનારાની વિગતો

સુરત મહાનગરપાલિકા જાહેર સત્તા મંડળ સાથે સંયુક્ત છે. અતેના ખાતાની અલાયદી માહિતી નથી.

કલમ – ૪ (૧) (ખ) (૧૪)
ઇલેક્ટોનીક સ્વરૂપમાં ઉપલબ્ધ માહિતીને લગતી વિગતો

સુરત મહાનગરપાલિકા જાહેર સત્તા મંડળ સાથે સંયુક્ત છે. અતેના ખાતાની અલાયદી માહિતી નથી.

કલમ – ૪ (૧) (ખ) (૧૬)

પ્રકરણ – ૮ (નિયમ સંગ્રહ – ૭)
સરકારી માહિતી અધિકારીઓનાં નામ હોદ્દો અને અન્ય વિગતો


જાહેર માહિતી અધિકારી :–

ક્રમ	નામ	હોદ્દો	એસ.ટી.ડી.કોડ	કચેરીનો ફોન નંબર
૧.	શ્રી પૃથ્વી એ. રાંગણેકર (કર્મ.નં.-૩૭૫૫૧)	કયુરેટર (કિલ્લો)	–	૭૦૬૯૬૮૫૩૭૫

અપીલ માહિતી અધિકારી :–

ક્રમ	નામ	હોદ્દો	એસ.ટી.ડી.કોડ	કચેરીનો ફોન નંબર
૧.	શ્રી મેઘાવી જે. દેસાઈ (કર્મ. નં. ૩૬૨૪૧)	કાર્યપાલક ઇજનેર	–	૯૮૭૬૭૬૨૦૭

Organisation Chart of Fort, Surat Municipal Corporation .



ઓર્ગનાઇઝેશન ચાર્ટ કિલ્લો, સુરત મહાનગરપાલિકા

